

ગ્રંથાલય

મનુષીય જીવન

૧૨/૧૩

દાદરાસાહેબ, લાયનગર.

ફોન : ૦૨૭૬-૨૪૨૫૩૨૨

૩૦૦૧૮૫



“ नमोत्यु णं समणस्स भगवां ऋषीरस्स ”

## आत्मानी उन्नतिना उपाये।

શ્રી બુંધઈ કોટવા જેન સંઘની વિત્તિને માન  
આપીને ૫. પૂ. આગમહિવાકર આચાર્યદેવેશ  
શ્રી આનંદ સાંજ રાજી સૂરીશ્વરજી મહારાજના  
વિદ્વાન् પ્રશિષ્યરત્ન શાસનસંરક્ષક પૂ. લુનિવર્ય

શ્રી હંસસાગરજી મહારાજે  
આપેક્ષા

## જાહેર વ્યાખ્યાન

: સ્થળ :

કોટ, માંગરોળ મેન્થનતા વિશ્વાળ હોલમાં : બુંધઈ

: સમય :

વૃ. સં. ૨૦૦૩ ના વૈશાખ સુદિ ૧૪

રવિવાર : સવારના ૬ થી ૧૧ા.



: પ્રધાનીઃ :

શ. માતીચંદ દીપચંદ

તંત્રી : શ્રી શાસન ચુંધાકર

મુ. ઠળીયા (જ. આવનગર)

નવં બાર મુખ્યાણા થા,

સુ. રાજપરા (કદમ્બગિરિ) નિવાસી  
 મહેતા છિગનલાલ ખુશાલભાઈના પુષ્યાંશ  
 તેઓશ્રીના ધર્મનિષ્ઠ સુપુત્ર  
 મહેતા કુંવરજભાઈ છિગનલાલની  
 ઉદાર આર્થિક સહાયથી ધર્મગ્રેમી સહગૃહસ્થેના  
 વાંચન મનન અર્થે સ્પ્રેમ

: ભેટ :

વીર સંવત् ૨૪૭૩  
સને ૧૯૫૭



વિકલ સંવત् ૨૦૦૪  
જેડ સુદિ ૪ શાનિ

[ નકલ ૧૦૦૦ ]

: પ્રાપ્તિસ્થાન :  
 શા. મોતીયંદ દીપચંદ, તાત્રી : શ્રી શાસન સુવાંકરે  
 સુ. ઠળીયા  
 વાયા-તળાણ ( ગુ. ભાવનગર )  
 [ કાઠિયાવાડ ]

સ્પેન : શ્રી કર્મસ્વતી છાપખાતું : ભાવનગર

॥ श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ॥

॥ पू. आचार्यदेव आनन्दसागरसूरीश्वराय नमः ॥

## श्री मुंभृष्ट कैटना जैन संघनी विनंतिथी आत्मानी उन्नतिना उपाये।

ऐ विषय उपर अपाये

जहुर व्याख्या

: व्याख्याता :

श्री शैक्षणा नरेश प्रतिभेष्ट, श्री वर्षमान जैन  
आगममंदिर संस्थापक, आगमहिवाकर प. आम्भेह  
कारक आचार्यदेवेश श्री आनन्दसागरसूरीश्वरज्ञ मठना  
विद्वान् प्रशिष्यरत्न शासन संरक्षक पूज्य मुनिवर्य  
श्री हंससागरज्ञ महाराज

दान शोल तपो भाव, मेदाद्वर्म चतुर्विधम् ।  
मन्ये युगपदाऽऽख्यातुं, चतुर्वक्त्रोऽभवद् भवान् ॥

धूम उपकारी शास्त्रकार महाराज डिकाल सर्वज्ञ पूज्य आचार्य  
भवान् श्रीमह छेमतं दसूरीश्वरज्ञ महाराज अव्यातमहने 'आत्मानी  
उन्नतिना उपाये' भवावतां इरामावे छे के:-

शाष्ट्रार्थः—दान, शील, तप अने भाव ए चार भेदवाणा चतुर्विध  
धूम ने एक साथे छही देवाने भवावं चार मुभवाणा भवा,  
एम हुं भावु हुं.

## શારીરિક ઉજ્જ્વલિમાં તો જનતા સતત પ્રવૃત્ત છે જ !

આ કલિકાલ સર્વંગ અગવન્તે સાડી ત્રણુ કરોડ પુષ્પ અન્થો શા માટે રચ્યા ? કહે કે જનતાને આત્માની ઉજ્જ્વલિના ઉપાયો અતાવવા. કઈ જનતાને ? ડેવળ શરીરની જ ઉજ્જ્વલિમાં રાચીમાચી રહેવાથી થતા બાબિ અનથેને નહિ સમજનારી જનતાને. શાઅ-કારોએ એ જનતાને ત્યાં સુધી કહ્યું કે યદિ શરીરની ઉજ્જ્વલિની છુંછા હોય તો પણ આત્માની ઉજ્જ્વલિને ઓળખવી આવસ્થક છે. આત્મીય ઉજ્જ્વલિના ઉપાયો જ જાણવા જરૂરી છે. કેમકે શારીરિક ઉજ્જ્વલિ પણ ધર્મથી જ ઉપલબ્ધ છે: આનો અર્થ એ નહિ લેતા કે શારીરિક ઉજ્જ્વલિ તથા તેના ઉપાયો તેઓએ બતાવ્યા છે. શારીરિક ઉજ્જ્વલિમાં તો જનતા સતત પ્રવૃત્ત છેજ, એવું સમજનાર તેઓએ જનતા તે પ્રવૃત્તિથી ‘આધિ, બ્યાધિ અને ઉપાધિથી પરિપૂર્ણ એવા’ આ સંસારમાં રવડી ન જાય એ માટે આત્મિક ઉજ્જ્વલિના ઉપાયો બતાવ્યા છે.

## પ્રથમ શારીરિક કાન્નિ પરદ્વે લક્ષ્ણ આપીએ

શાસ્ત્રકાર મહારાજા કહે છે કે શરીરની કાન્નિ પણ ધર્મથી જ પ્રાપ્ય છે. શારીરિક કાન્નિમાં પણ પુષ્પભેદ છે. સૂર્ય (વિમાન) લગભગ નવસે યોજન ફૂર છે, છતાં તેની સામે જોઈ શકાતું નથી. તો સમીપસ્થ હોય તો જોઈ જ કેમ શકાય ? જેના ધર (સૂર્ય-વિમાન)ની સામે મીઠ ન મંડાય એ ધરના માલિક ઈન્દ્ર નો પાસે ઉભા હોય તો તેમના સામે કેમ જ જોઈ શકાય ? સૂર્યનો પ્રકાશ તો તેની પાસે કાંઈ હિસાયમાં નથી. એ ઈન્દ્ર મહારાજનું મૂળ-સ્વરૂપ જોવાની ‘હેવો મૂળસ્વરૂપે અહિં નથી આવતા એમ જાણુનાર’ શ્રી ભરત ચક્રવર્તીને ભાવના થઈ. ભરત મહારાજ તે જોવા ઈન્દ્રને વિરાપિત કરે છે. સાધમણી ધર્યા પૂરી કરવી એ ફરજ સમજનાર ઈન્દ્ર મહારાજ જાણે છે કે એ સ્વરૂપ ભરતજીથી જોઈ

શક્તાય તેમ નથી; ઈન્દ્ર મહારાજની આવી માન્યતા માનથી, ગર્વથી કે ગૌરવથી નહિ, પરંતુ તથાવિષ પરિસ્થિતિની છે.

ચક્રવર્તીની સમર્થ દણ્ણ પણ અહિ હરી ન શકે. બાહુઅળીજુનો અપવાદ બાદ કરતાં ભરતચ્છીના દણ્ણસમર્થથી, જગતમાં ભીજ ક્રાઈનું દણ્ણસમર્થ વધે તેમ નથી. આવી દણ્ણ પણ ઈન્દ્ર મહારાજનું મૂલસ્વરૂપ જેવા અસમર્થ છે. વિષુધ એવા ઈન્દ્ર મહારાજે ના તો કહી, પણ એવી કળા કરી કે ભરતજીએ પોતે જ મૂલસ્વરૂપ જેવાની ના કહી. પોતાની કનિષ્ઠા અંગુલિમાં પોતાના મૂલસ્વરૂપની પ્રભા આરોપી ભરતજી સામે ધરી; આ જેતાં ભરતજીની આંખો ભીચાઈ ગઈ. તેઓ સમજ ગયા કે મૂલસ્વરૂપ જોઈ શકાય તેવું નથી. આ વાત તો ધર્મથી પ્રાપ્ત એવી શારીરિક કાનિતની થઈ. સૌધર્મ ઈન્દ્ર તો પ્રથમ દેવલોકના ઈન્દ્ર છે. તે પછી જેમ જેમ આગળ વધો તેમ તેમ કાનિત વધો. તીજા દેવલોક આથી અદ્ભૂત કાનિત, બારમા દેવલોક કેદુંગુણી અદ્ભૂત કાનિત, પછી આગળ વધો, નવગ્રેવેયક તથા તેથી આગળ અનુતાર વિમાનવાસી દેવોની કાનિતમાં પૂછવું જ શું? વિજય-વૈજયંત-જયંત-અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવોના અનુક્રમે વધતા જગઝગાટની ક્રાઈ સીમા નથી; કાનિત, અદ્ભુત તમામ આનિર્વચનીય. ઘોળે દ્વિસે જેમ પૂર્ણિમાનો ચંદ્ર શીક્ષો દેખાય, તેમ સૂર્ય પણ ઉચ્ચ દેવલોકની કાનિત પાસે શીક્ષો દેખાય! એ લાખ જોજનના મેરનો ઝાંઝરીયો થઈ ને નીચો જ રૂપી કરે! ઉંચે એની જરૂર નથી. આં શારીરિક કાનિત આહિ પણ અધૂરા ધર્મનું જ પરિષુદ્ધ છે

ઉચ્ચ દેવલોક સૂર્યની જરૂર જ કયાં છે? કેમકે ત્યાં તો સૂર્ય જ શીક્ષો પડી જય છે. ઘોળે દ્વિસે પાંચસે પાવરનો ગ્રોઅ શીક્ષો જ દેખાય ને? આપણો મુદ્રો છે આત્માની ઉત્તરિનો. આ તમામ કાયાની કાનિત પણ મળો શાથી? ધર્મથી જ. સૌધર્મેન્દ્ર

દક્ષિણ ભૂમિના માલિક છે. ડ્રાઇ પર રેખે ભરાઈને તાં બેઢા અર્ધાં નજર કેંકે, તો એલો ખાખ થઈ જય ! હવે પુણ્યબેદ્ધ કાનિતબેદ્ધ છે, એ સુદ્ધા પર આવીએ. આ તમામ કાનિત શારીરિક છે, ધણે ઉચે રહેલી છે, છતાં પણ તેની સામે જોઈ શકાય નહિ તેવી છે. જ્યારે શ્રી જિનેશ્વર દેવની શારીરિક કાનિત તો એ સર્વ કરતાં કેઠગુણી વધારે હોવા છતાં તેમની સામે અનિમેષપણે જોઈ શકાય છે ! પ્રભુની મુખપ્રલાનુજ બાર સુર્યની કાનિત જેટલું પ્રમાણું શાસે આપ્યું છે. દેવોની કાનિત ગમે તેવી ઝગજગાટવાળા, પણ જોઈ ન શકાય તે શા કામતી ? મેરું લાખ જોજનનો ય સોનાનો પણ ભરતક્ષેત્રાદિના માનવીએને શા કામતો ? દેવોના અને ઘન્દ્રોના ન જોઈ શકાય તેવા સ્વરૂપના તથા શ્રી જિનેશ્વર દેવના જોઈ શકાય તેવા સ્વરૂપના બેદમાં કારણું તરીકે પુણ્યનો બેદે છે. એ એ ય પ્રકારની કાનિત, ઋડિક આદિ મલ્યાં શાથી ? ધર્મથી જ. દેવો દેવ થયા તે ધર્મથી ને ? આજે કુદકે ને ભૂમદ્ક વિજ્ઞાન આગામ વધતું કહેવાય છે, પરન્તુ અજ સુધીમાં ડ્રાઇ વિજ્ઞાની એવો પાકચો કે-જે માનવીને દેવ બનાવે ? માનવીને દેવ બનાવનાર કેવળ ધર્મ જ છે. અનુત્તર વિમાનની શારીરિક કાનિત ડિયામાં ઉંચો, તે ય અધુરા ધર્મથી : સાત લવ આયુષ્ય એષ્ટું તથા છદુ જેટલો તપ એઠાં : આટલો અધુરો ધર્મ, તેના ચોગે દીર્ઘકાળની શાહુ જેલ જેણું એ સ્થાન એને સાંપણું ! ઇપ, કાનિત, ડાઠ વિગેરે છે તો અદ્ભૂત, પણ જુએ ડાણું ? એ દેખાડી ઉપકાર કરે હોને ? ન જોઈ શકાય એ વાત તો અધ્યગ પણ એ વિમાનવાસી દેવો ત્યાંથી તેત્રીશ સાગરોપમ જેટલા લાંબા કાળ સુધી બીજે જરૂર જ શકે તેમ ક્યાં છે ? સાત લવ આયુષ્ય વધારે હોત, છદુ તપ વધારે થયો હોત તો તેઓ પૂર્ણ ધર્મયોગે સાદિ અનંત રથતિવાળા આત્માય કાનિત (સુકીન) ના માલિક બની

જાત. આત્માની ઉત્તેતિ શાથી થઈ શકે તેમ છે તે આ ઉપરથી સમજન્યા હશે ?

એ ચોગ્યતા સાંપડી છે કે ધર્મના જ ચોગે છે

આ યુક્તિપૂર્વક કલિકલ સર્વજી અગવાન શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે-શારીરિક ઉત્તેતિ પણ ધર્મથી જ મળે છે. તેઓ કહેવા માગે છે, આત્માની ઉત્તેતિના ઉપાયો. આ ઉપાયો આપણે અસ લોળપણથી માની લઈએ, ધૈર્યાથી ‘હા’ લખીએ એટલા માત્રથી આત્માની ઉત્તેતિ એછી જ થવાની છે ? આપણે આત્માની સાચેજ ઉત્તેતિ ધૂંઘણ્ઠા હોધાએ તો તે ઉપકરીએ અતાવેજ ઉપાયો સમજુને આદરવા જ રહ્યા, અને એ સિરાયના આત્માની અવનતીના ઉપાયોને તજવા જ રહ્યા. આત્માની ઉત્તેતિ કરનાર કેવળ ધર્મ જ છે. તે ધર્મમાં પૂર્ણતાએ પહોંચવા મયી મરવું જોઈશે. ‘ધર્મ, ધર્મ,’ કર્યે કાંઈ ન વળે. ‘આત્મા અનંત અળવાન છે, અનંત ગાનવાન છે’ એમ માત્ર ગોખ્યા કર્યે જ શું વળે ? ધર્મ કરનારો ઇપહીશો પણ રહે ? પત્થર થાય તો પણ હીરો થાય હીરો ! અભવ્ય કુલક અણેલા જાણુતા હશે કે પૃથ્વીકાયમાં ખીણુમાંના પત્થરના જીવોમાં ભય પણ હેંય, અભવ્ય પણ હોય. કારીગર જિનમૂર્તિ ધડવા માડે. ખીણુમાંના પત્થર લ્યે, તેમાં જેને અભવ્ય જીવે અહણુ કરેલો હોય, તે ટાંકણું મારતાં તૂટી જય ! અથીત અભવ્યનું શરીર જિનમૂર્તિમાં પણ કામ ન આવે ! શાથી ? ભાગ્યની હીણુતાઃ પૃથ્વીકાયમાં ઉપજનાર પુણ્યવંત જીવ હીરો થાય, જવેરીના હાથે ચડે ! હીણુપુણુિા પત્થરા જ થાય. જવેરી એને અડે ય ખરો ? પુણ્ય-પાપનો, તેણી વૃત્તિનો તક્ષાવત તો તમને દુનિયાના બ્યવહારમાં ય હેખાશે. મરનાર તો મરી જય, પણ એ એવો હોય કે તેની પાછળના ધનને, વરતુને ક્રાઈ અડે નહિ, કહે કે-ર્યે અડતા ! એ ધન લીધું તો પાસે

હશે તે ય જરો ! આ શાથી ? આત્મા તો ગયો, પણ તેવી અશુભ વૃત્તિ મૂકતો ગયો. અપુત્રીઆતું, કૃપણતું, નિરાધારનું ધન ન લેવાય એમ મનાયું, શાથી ? છે તો તે ય ધન, અને તેનો તેવો માલિક પણ ગયો, છતાં ય એવી માન્યતા શાથી ? કહો, માલિક ગયો પણ વૃત્તિ મૂકતો ગયો. દુનિયામાં ડાલ્ખાઓએ નિયમ કર્યો કે-દીકરીના ધરનું પાણી યે ન પીવાય. લેનારા બલેને પચાસ હજાર લે. લેતાં ડિજળા હેખાય, પણ અંતે તમામ સાડે થઈ જાય છે ને ! આ તમામનું ધન તેવી વૃત્તિના કારણે જ નથી લેવાતું ને ? જ્યારે મુનિ કાલધર્મ પામે, તેની પાલભીમાંથી કુકો વસ્ત્ર તથા ઉછળેલા પૈસામાંથી ચેસો લેવાતું મન થાય; લેવા પડાપડી થાય ! શાથી ? એ લેવાથી ઋદ્ધ થાય, વૃદ્ધ થાય, એવો લાં આશય છે. દીવાળાએ બોણી ડાની કરો ? બોણીમાં નામ ડાનું લખો ? કહો કે-ઓલદોલનું, તોકલીનું ? આમાં યોગ્યતાની વાત આત્માની કે શરીરની ? યોગ્યતા આત્માની છે. શરીર તથા ધન વિગેરતી તો સમાનતા છે. શરીરના સેવકાએ આ વિચારવાતું છે. માનવે માનવે ફરક છે. એક માનવ શોધ્યો ન મળે, અને એક ટકાના તેર ! શકુનમાં જૂણો ! વિધવા સામે મળે તો પાણું ફરાય, સધવા સામે મળે તો આગળ વધાય, તે સાથી ? સ્થીએં તો એ ય સરખી છે, વિધવા હસ્તી મળે તો ય વાંધો અને સધવા રડતી મળે તો ય આગળ વધો ! શાથી ? આમાં તફાવત પુષ્પ-પાપનો છે. આ સમજણું આર્થિકામાં છે. આજે કાંઈ યોગ્યતા સાંપડી છે, તે પણ પૂર્વીકૃત ધર્મથોગે સાંપડી છે. આ સમજણું જરૂરી જય તો સૌ હમણાં જ ધર્મ તરફ ઝૂકી જય; પણ મોહરાજ એ વરતુ આપણુંને યથા સ્વરૂપે સમજવા હેતો નથી. આપણું હેવ કેવા ? અરૂપી આત્મા પર ચિત્રામણ કરનારા ! યોગ્યતાનું આ ધરતર ડાણે કર્યું ? કુશળ સલાટ પણ થર ધર્મ,

પણ આત્માનાં ધંડતર કોણું ધડે ? પત્થર તો રૂપી, પણ આત્મા તો અરૂપી છે. અરૂપી દ્વય હાથમાં આવે ? નહિ જ. આકાશ અરૂપી છે, એમાં ચિત્રામણુ કરનારો કોઈ વિજ્ઞાની પાક્યો ? આકાશની જેમ આત્મા પણ અરૂપી છે. આકાશમાં કરેલ ચિત્રામણની જાહેરાત કરવામાં અને અમુક રીતે રખાય તો દૂરદૂરથી વિમાનમાં એસી લોકો જેવા આવે, જેવાં આવનારની પડાપડી થાય; પણ આ આકાશમાં ચિત્રામણુ કરનાર હેવને પરાણે એળાખાવવી પડે છે ! જેવા અને સાંભળવા તેડાં કાઢી એલાવવા પડે છે ! અરૂપી આત્મા પર ચિત્રામણુ કરનાર આપણું અરિષ્ટંત હેવ છે. આ હેવને સહેલે એળાખી શકીએ તેવા કુલમાં આપણે જનમ્યા છીએ, પણ ‘અરૂપી એવા આત્માને ચિત્રામણુ કરનાર અમારા હેવ છે,’ એમ કહેવા છતાં તે હેવને હજુ આપણે યથાન્ય એળાખ્યા જણ્યાતા નથી. અન્ય દુનિયાના ડાઢા પ્રાણીએ પણ આ હેવને તાડીને જોઈ રહે છે. એ હેવના વારસદાર એવા આપણે હજુ તેને એળાખી શક્યા નથી ! આ રિથતિમાં આત્માની ઉત્તરિ કેમ થાય ?

**કણુતરને ચણુનું મન માંસાહારીને પણ થઈ જાય છે !**

યોગ્યતાને સમજવવા બિન બિન દૃષ્ટાંતો વિચારી શકાય. બેંસ અને ગાય. બજે પણું, બજે દૂધ આપે છે, પણ ગાયનું દૂધ પવિત્ર મનાય એવી લાં છે—પુષ્યની યોગ્યતા. ઊંઠે પણ ‘ગરીબ ગાય જેવી’ કહેવાય પણ ‘ગરીબ બેંસ જેવી’ કહેવાય ? અને કહો તો ? સાંકળે તો બેંસ પણ બંધાય છે, ગાય પણ બંધાય છે, પણ ગાયને ગરીબડી કેમ કહી ? સ્વીને પણ ગરીબ ગાય જેવી કહી ગાય સાથે ધરાવી ! હેવ પાસે દીવામાં ગાયનું વી જોઈએ, આજે બલે તમે બેળેઅલ ધીનો દીવો કરો તે તમે જણો. ‘દીકરીને ગાય, હોરે ત્યાં જય,’ એમ કહ્યું: હોરે ત્યાં બેંસ પણ જય તો છે, પણ ‘દીકરી ને બેંસ, હોરે ત્યાં જય’ એમ ન કહ્યું:

આપના જીવમાં એ યોગ્યતા પુણ્ય યોગે આવી છે. એ યોગ્યતાથી એ જીવે ગાયપણું મેળવ્યું, બેંસ ન થઈ. કષુટર તથા કાગડો બજે પંખી, પણ એક એવું કે-જીવ તો શું પણ સરેલો દાણો ય ન જ ખાય! જ્યારે કાગડો ભાજ્યો જીવ ન મૂકે! કષુટરનો આત્મા એટલો યોગ્ય. આથી કષુટરને ચણું નાખવાનું સહૃદ્દ ડોધને મન થાપ છે. રેશનીગના જમાનામાં ય કષુટરને તોટો છે? ભૂલેશ્વરના કષુટર ખાનામાં જૂઓ જઈને, ચાર ચાર અંગળ ચણુનો દળ પડયો હોય છે! કષુટરો કલ્લોલ કર્યા જ કરે. ત્યાંથી પસાર થતાં મહિદારીને ય ચણું નાખવાનું મન થઈ જાય છે! સાથી?

જંખના જ હશીએ પણ પ્રયત્ન ન હશીએ તો શું વળો?

અરૂપી એવા આત્મામાં ચિત્રામણું તારક દેવોએ કરેલ છે. તેએ આત્માની ઉત્તરિના ઉપાયો. કષી ગયા છે. એ ઉપાયોને આજે ધ્યાશક્તિ અવગાહિએ. પૂર્ણપણે આદ્ધરીએ એવી તો આપણુંમાં તાકાત નથી. આ ચિત્રામણું તારકાએ નવું કરેલ નથી. છે તે ખુલ્લું કરી બતાવેલ છે. ચિત્રામણું છે જ પરંતુ તેની ઉપર કર્મરજના દળ ચડી ગયા છે. થર જમી ગયા છે. એ ડુખેડે કોણું? ઉખેડનાના ઉપાયો બતાવે કોણું? ધરમાં નિધાન તો છે; પણ ધરધણીને ઘરર નથી. તે મુંઝાય છે, ત્યાં ડોઈ ઉપાય સહિત દેખાડે તો કેવો આનંદ ચાય? દેખાડનાર તો કહે, ‘નિધાન છે, અહિ છે, આટલે ઉડે છે, આ રીતે મળે,’ પણ ધરધણીએ કોણ, કોણણા, પાવડો લઈની ઓદીને કાઢવાની મહેનત તો કરવી પડશે ને? એ ધરના ખનને ઓદી કાઢવા માટે કોણ-કોણણા-પાવડો છે, તેમ અહિ આત્મચિત્રામણું પર ભીરતીર ન્યાયે જમેલાં કર્મને દૂર કરવા ગુનીએ ક્યા ઉપાયો અતાબા? ‘દાન, શીલ, તપ અને લાલ.’ આ ચાર પ્રકારનો ધર્મ આચરવાથી અનન્ત ચિત્રામણુવાળું આત્મસ્વરૂપ પ્રગટ ચાય. ઉપાય જણ્યીએ ખરા પણ આચરીએ

નહિ તો ? પૂર્ણુતાને પ્રાપ્ત કરાવનારી માનવકાયા ભળવા છતાં,  
પ્રથમ ન કરાય તો શું વળે ? ધનની જંખના કર્યા કરીએ પણ  
આલિબદ્રતું પુણ્ય ન આચરીએ તો નવાણું ચેટીમાંની ‘પા’  
પેટી એ આવે ખરી ?

અંતરથી ન્યારે રહે, શાથી ?

માનવ આચરી શકે તેમ છે માટે જ્ઞાનીએ તેને ઉપાય  
બતાવ્યા. બીજેએના કલ્યાણુની કામના તો લારોભાર છે, પણ  
થાય શું ? એકન્દ્રિયાદિને પ્રવયન મંભળાવે ! નારકી સાંભળી શકે ?  
દૂવો નવરા છે ? એ તો લોગ-વિકાંસમાં પઢ્યા છે, એ ધર્મ કંચાં  
કરી શકે તેમ છે ? મનુષ્ય જ ધર્મ આચરીને ઉત્તુનિ કરી શકે  
તેમ છે. માનવ, ધર્મ વિહેણો થાય તો બહુ જોખમમાં. નીચે જ  
ઝાય. કારણું કે, તે ધર્ઘછાપૂર્વક અધર્મ આચરે છે. ધર્મી મનુષ્ય  
હુલ્કડ કરે ? અખતરા માટે એંચ હેંકું લાખો જીવોનો નાશ કરે ?  
આપણે ધર્મ, કુલથી પામ્યા પણ વિચારણા છે ? આત્મવત્ત સર્વ-  
મૂત્રેષુ બોલાય છે, પણ વર્તનમાં તેમ છે ? એક પાણીના અન્દુમાં  
અસંખ્યાતાં જીવ હોવાનું જાણ્યા પછી ખાલો પીતાં કંપારી ન  
આવે ? અનિવાર્ય હોય એ બીજી વાત, પણ હૃદય કયું હોય ?  
સચિત પદાર્થી હેંશે વપરાય ? એકન્દ્રિયાદિ ડોઈ પણ જીવોને કામનો  
નથી તે માનવને બીજી જીવોને કરડી ખાવાનો શું અધિકાર ?  
એકન્દ્રિય, એધન્દ્રિય આદિ ડોઈ જીવો માનવને ખાય છે ? માનવને  
એ બધા કામમાં આવે છે, પણ માનવની રાખ પણ એ દરેક  
જીવોને કામની છે ? નહિ, તો માનવ ડૂવો કે જે તેવા નિરપરાધિ  
અને અશરણું જીવોને પણ કરડી ખાય ! અલ્યા ! તું બધાને મારે,  
તને ડોઈ ન મારે ? ‘માર્દ મારા આપનું, તાર્દ માર્દ સહીયાર્દ’  
આ રીતિ માર્ગાનુસારીને પણ ઉચિત હોય, એમ લાગે છે ?  
સમ્યગુદૃષ્ટ આત્મા સચિત પદાર્થ પણ ખાતો-પીતો હોય, પણ

માને કે નખુટકે કરવું પડે છે: એમાં રાજ ન થાય, તન્મય ન થાય, દુને !

મરાઠીમાં કહેવત છે કે—‘ચાવલ તેનાલા ચાવાવા’ એટલે કે જે મારે તેને મારવો. અને વળી તે ‘પાંડુરંગનિ સાંગિતલા’ કહી એ હવાલો ઈષ્ટહેવ પાંડુરંગના નામે ચઢાવે છે! મતલાય કે—‘મારે તેને મારવામાં પાપ નથી’ એમ પાંડુરંગે કહ્યું છે. ’ એમ કહીને તેઓ કહે છે કે—સર્વ કરડીને બીજાને મારે છે માટે તેને મારી નાખવો ! પણ એને પૂછીએ કે તું સર્વને મારે છે તો તારા માટે કયો ન્યાય ?

ધર્મ કયો ? અધર્મ કયો ?

સભામાંથી પ્રક્ષાઃ—‘આખી દુનિયાએ માંસાહાર નથી તજયો, માટે માંસાહારનો નિષેધ કેમ કરાય ? આવી આજે ચાલી રહેલી દલીલખાજુનો શો રહ્યો ?’

માંસ ઈષ્ટ હોવાથી માંસાહારના સિદ્ધાંતો ધડાયા છે તેમ ચોતાને પાપ ઈષ્ટ હોવાથી પાપસિદ્ધાંતો ધડાય છે. આવા આત્મા-એઓ કથાં જવાના ?

આખી દુનિયા પાપમાં રાચતી હોય ત્યારે શ્રી જિનેશ્વર દેવ ધર્મોપદેશ દે, એ યોગ્ય નથી ? અધા જ ધર્મની જરૂર માને લ્યારે જ ધર્મોપદેશ આપવો એમ ? શ્રી જિનેશ્વર દેવો ધર્મદેશના છાને હે છે ? અધર્મની-હિંસકાને. આદિતાથ પ્રભુએ ધર્મ કહ્યો લ્યારે તો લોકા યુગલીઓ જેવા જ માત્ર હતા ને ! શ્રાવકું છાઈ હતો ? યુગલિકાના જ્યાલમાં અસિ, મસિ, કૃષિનો શુષ્ણ પણ નહોંતો. તેવાઓને નીતિમાં જોખા બાદ અલે અગવાને ધર્મ કહ્યો, પરંતુ સંસ્કાર તો શિક્ષણુના સદંતર અભાવવાળો જ ને ? આ વર્ગમાંથી પ્રભુએ સાંદુ, સાંધી, શ્રાવક, શ્રાવિકા ૩૫ સંધુ

સ્થાયો અને તેને જ ધર્મ આયો, એમાં ડોઈ શક છે ? આ ધર્મ, ધર્મની આયો છે ? દુનિયામાં ધર્મા દાડીઓ હોય માટે દાર પર પ્રતિઅંધ ન થઈ શકે એમ ? જાણ ચોર તથા ખૂની હોય માટે ચોરી તથા ખૂન પ્રતિઅંધ લાયક નહિ, એમ ? આથી સમજ્યા હશે કે-પાપમાં પ્રતિઅંધ મૂકવો તે ધર્મ છે અને પ્રતિઅંધ ન મૂકવો તે અધર્મ છે. દુંકમાં શક્તિ છતે દ્શ્ટ રહેવા હેઠી કે આપવા માંડવી તે અધર્મ જ છે. ધર્મજીન તે નથી જ કે-જે શક્તિના સમગ્રે પાપ પર પ્રતિઅંધ મૂકવાનું ભૂલી પાપની દ્શ્ટ આપવા માંડે છે.

**ધર્મ વિહેણોણો માનવી અતિ નીચે જય છે**

શાસ્ત્રકાર બતાવે છે આત્માની ઉજ્જ્વિના ઉપયોગ, એ બરે-બર યાદ રાખો. જનતા વળો છે શારીરિક ઉજ્જ્વિ તરફ. માટે તેને કહે છે કે-યદિ કાયિક ઉજ્જ્વિ જોઈની હશે તો ય આત્મિક ઉજ્જ્વિ એણખી પડશે. શારીરિક ઉજ્જ્વિ પણ ધર્મથી જ પ્રાય છે. શરીરના વૈઘ તો શોધ્યા ભલે, પણ આત્માના વૈઘ ? શરીરના વૈઘને આપવું પડે, આત્માના વૈઘ કાંઈ લે નહિઃ દેનારા ઉપકાર કરી શકતા નથી. આત્માની ઉજ્જ્વિ બતાવનાર તારકદેવે જેયું કે-અધી જાતો કરતાં માનવજીત માટે ધર્મની પરમ આવસ્યકતા છે. ધર્મવિહેણો માનવી પણ કરતાં તો સ્વપરને અતિ લયંકર છે. પોતાના આત્માને અતિ નીચે લઈ જનારો બને છે. ફૂર-કરાળ સિંહ મરીને ચોથી નારકી સુંધી જય અને માનવી સાતમી નારકી સુંધી જય ! શાથી ? ધર્મ વિહેણો માનવી છરાદ્ધપૂર્વક ધોર :પાપો કરે છે. કો અતંત પાપની રાશીચાળ્ય છતાં છુટી નારકી સુંધી જય અને પુરુષ પુરુષ રાશિનાંગો છતાં સાતમી નરક સુધી જય ! શાથી ? અખા રાડોઢની માઝક, ધર્મના અભાવે ખી કરતાં તે ધર્મો કઢોર બનીને પાપ કરે છે. ઢોરની એ તાકાત નથી. ઢોરા બેભાન માનવીની જેમ અકાળે કામસેરન-

નથી કરતા. મનુષ્યમાં વિવેક જોઈએ. નીતિકારોએ પણ કહ્યું છે કે-ખોનો ભોગ કાળે તેમ જ કણના હેતુએ છે. પણ ગાંડાએ માનતા નથી. અને હેરાન પરેશાન થઈને કિંમતી જિંદગી અકાળે બરબાદ કરી નાખે છે. કણના વિવેક વિના યથેચું વિષયી બન્નો રહે એ માનવ છે કે દ્યાનવ ? આવાને માટે 'હેવાનુપ્રિય'ને બહલે ખીજું જ કાંઈ કહેવું પડે, એ આકર્ષણ કહેવાય ? બહુ આકર્ષણ કહેવાય ?

**સલ્લામાનથી:-** 'હેવાનુપ્રિય' આદિ સંખોધનોથી જ હિત-ગિદ્ધાની અસર થાય ને !

પણ તે યોગ્યને ને ? તો પછી સારથ્યા, વારથ્યા, ચોયથ્યા, પડિએયથ્યાનો અધિકાર છદ્દાસ્થને કેમ સોંપ્યો ? હોરા પણ મારે ને ? વહુ ધરે આવે પછી સાસુ કાંઈ કહે જ નહિ ? મોડી ઉઠે તો ય 'ભલે-ભલે' કરે ? કે જરા આકોશ કરી વહેલાં ઉઠવાનું કહે ? પહેલાં તો વરની મૂકી કન્યા જતી, હવે તો કન્યાના મૂક્યા વર જય છે ! વરની કેટલી કિંમત રહી છે ? વિચારો. આવા આ સદીના 'નાના હોય તો જૂદી વાત છે પરન્તુ' મોઢે મુખ્યાળા થયા છતાં કેટલાક અયોધ્ય બની ગયેલા આત્માઓ માટે પણ 'હેવાનુપ્રિય' આદિ મીડા શર્ખ્ટો જ સુધારરા બસ લાગે છે ?

**પ્રસન્ન થનારાએ સ્વનો પણ ઉદ્ઘાર કરી શકતા નથી**

શરીરની દ્વારા કરનારા માટે ચૈસો જોઈએ છે. આત્માના ઔષધ માટે ચૈસા નથી જોઈતા. તાં જોઈએ છે ભક્તિ. ભક્તિ પણ આત્મોભૂતિનો જિજ્ઞાસુ જ કરે. આત્માનો વૈદ્ય ભક્તિ છચ્છે નહિ. આ વૈદ્ય તો સદનતર છચ્છા વગરના. આપે જ આપે ! ઔષધ પણ અમોધ આપે. સામો ભક્તિ કરે તો પણ ન થાય પ્રસન્ન કે ન આપે આશીર્વાદ. એમની ભક્તિ જ હુણે, એવા એ અપૂર્વ ! આપવાથી પ્રસન્ન થનારાએ કાઈ પણ આત્માનો ઉદ્ઘાર

ન કરી શકે; આપે તો પ્રસન્ન થવું એ આત્માનો ગુણ નથી. પ્રસન્નતા કે છંચા વિના જ સહજ લાવે આપ્યા કરે એ આત્માનો ગુણ છે.

### પ્રક્રિયા-એ શા રીતે ?

સૂર્યની છંચા નથી, છતાં ય એ પૂર્વ પદ્ધિમ કર્યા જ કરવાના સ્વભાવવાળો અની મ્યુનિસિપાલિટીનું કામ કર્યા જ કરે છે ને ?

પ્રક્રિયા-‘સવી જીવ કરું શાસન રસી’ એ છંચા તો પ્રલુને હતી ને ?

પ્રથમના લવોમાં એવી છંચા હતી. આ તો વર્તમાન અવતી વાત છે. ત્યાં છંચા નથી. આ અંતિમ લવે તો જે ઉપકાર થાય છે, તે સ્વભાવતઃ થાય છે. અહિ આપણે દેવ છંચા વગરના માન્યા છે અને પ્રતિતી અંતિમ સ્વરૂપથી રાખ્યો છે. શ્રી જિનેશ્વર દેવતી મૂર્તિ કઈ અવસ્થાની મનાય છે ? ચૌદમા ગુણું સ્થાનકના છેલ્લા અંશે રહેલા આયુષ્યના અંત સમયના સ્વરૂપની.

### નવપદમાં નમો અરિહંતાણ શાથી ?

નવપદમાં પ્રથમ પહેં નમો અરિહંતાણ રાખ્યું છે. નમો મહા-વીરાણ કે નમો પદ્મનાભાણ તો નહિ પણ નમો તીર્થયરાગ પણ નહિ ! ત્યાં તો નમો અરિહંતાણ જ. શ્રી અરિહંત પણ કેવા ? ચાર ધાતીયાં દૂર થયાં હોય તેવા માત્ર નહિ, તેવા તો સામાન્ય કૃવલી પણ હોય. જેએ જ-મથી જ અર્હ ધાતુની યોગ્યતા લઈની આવ્યા હોય અને જેએએ અર્હ ધાતુનો આજીવન સાક્ષાત્કાર કર્યો-કરાયો હોય તે અરિહંત છે. એ પૂજા અર્થવાચક અર્હ-ધાતુથી અર્હતાને પામેલા અને આજીવન પૂજયા હોય છે. જેમનો ઘાનાતિશય અંદભૂત હોય, જેમનો વચ્ચનાતિશય અલોકિક હોય, જેમને અપાયાપગમાદિ મૂળ ચાર અતિશયો અલખેલા હોય.

ચોત્રીશ અતિશયોથી જેએ અલંકૃત હોય, ત્રિલોક પુણ્ય હોય,  
એવા અરિહંત હોય છે. માટે શ્રી નવપદજમાં નમો અરિહંતાણ.

**પ્રશ્નઃ—‘તીર્થકરાણ’ કેમ નહિ?**

‘તીર્થંકર’ શખ્ષદ્પ્રેરોગ તો પ્રભુ ગર્ભમાં આવે ત્યારથી  
બ્યવહારમાં કરવામાં આવે છે. જ્ઞનમકલ્યાણુકાદિ તીર્થંકરનું જ  
કહીએ છીએ ને? એ તીર્થંકર તો પરણે ય ખરા, ગાદીએ ય  
એસે માટે નમો તિત્થયરાણ શખ્ષદ્દને નવપદમાં ન લીધે. પણ તેઓમાં  
આજુવનથી રહેલ અર્હતા, પૂર્ણતાને પામી એટલે નમો અરિ-  
હન્તાણ જ લીધે.

**પ્રશ્નઃ—તીર્થંકરમાં તથા એ અરિહંતમાં ફરદ શો? એમાં  
ક્રાણ વધે?**

ઇપીએ અને તેની એકસો બાણું પાઈ, એટલે ફરદ.  
દ્વાયીમાં પડેલો બાધ્યો ઇપીએ પરચુરણું ચીજવરતુ વસાવવાના;  
કામમાં ન આવે, છૂટો થયા પછી તે કામ આપે. અરિહંત દેવ  
આત્માની વરતુને વસાવી હેનારા છે. તીર્થંકરદેવ અર્હતાને ખીલવી  
પૂર્ણતાને પામ્યા એટલે અરિહંત કહેવાયા. જનતાને આત્માની  
ઉજતિના ઉપાયો અરિહંત દેવે બતાવ્યા. સહૃથી પ્રથમ બતાવ્યા.  
કાંઈ બદ્ધા વિના બતાવ્યા. ધોર ઉપસર્ગો સહેવાનાં અને તપ  
તપવાનાં ઉદાહરણો પીરસીને બતાવ્યા. દુર્ઘણ વિના બતાવ્યા.  
ઉપદ્રવ કરનારને પણ બતાવ્યા. કહ્યું છે કે—

કૃતાપરાધેઽપિ જને, કૃપાસંયરતારયોः ।

ઇષદૂગાષ્ઠાર્દ્યોમંદં, શ્રીવીરजિનનેત્રયોः ॥

**શખ્ષદ્દાથઃ—અપરાધ કરનાર માણુસને વિષે પણ પ્રજ્ઞ  
મહાશીર હેવની આંખોની, ‘અશ્રુથી કાંઈક લીજાઈ ગયેલી, કૃપાનાં  
રવૈયા ઇપ’ કીકીએમાં કલ્યાણ લરેલું છે.**

આવી ઉપકારવૃત્તિએ આત્માની ઉત્તરિના ઉપાયો પ્રભુએ માનવીએને બતાવ્યા.

### આરિહંત અજખ આત્મવૈઘ છે.

એમના તપને ધોર કલ્લો: ‘વીરસ્ય ધોરં તપો ।’ ધોર એ ખરાય વિશેષણુ કે ઉત્તમ ? ડોઈને એ વિશેષણુ આપ્યું હોય તો ફૂફડી ઉઠે કે નહિ ? પણ શ્રી તીર્થંકરના તપને અંગે એ વિશેષણુ ઉત્તમ અની ગયું ! કેવો તપ ? ‘સાડાભાર વરસ જીન ઉત્તમ, વીરજ શૂભી ન ઢાયા,’ ગોખે છે ને ? આવા તપોરત તારકે આત્માની ઉત્તરિના ઉપાયો આપણુને બતાવ્યા છે. તેઓ આત્માનું સામર્થ્ય પૂર્ણપણે જાણ્યા હતા, માટે આયુષ્યના અંતિમ સમય સુધી આ ઉપાયો, એક સરખી રીતિએ, એકધારા અતાવી શક્યા છે. છે કુચાઈ લેશ પણ ફેરફાર ? બ્યવહારમાં પણ ટોચનો શાહુકાર તે કહેવાય કે જે જીવનના છેલ્લા શાસ સુધી લીધાના ‘ના લીધા’ ન કહે. અને કહે તો ? છેલ્લે શાસે ય તેમ કહી હે કે—‘દુંટીમાં હતું તે નીકળ્યું !’ પછી શાહુકારીની છાપ ખતમ ! શ્રી અરિહંત દ્રેવ અજખ આત્મવૈઘ છે. શરીરના ધન્વંતરી વૈઘની જેમ અરિહંત એ આત્માના ધન્વંતરી વૈઘ છે, તે ય કેવા ? વૈઘ ધન્વંતરી હોય પણ દ્વારા ન હોય તો ? આ વૈઘ તો રોગ પારએ, ઉપાય કહે અને ઉપાય પણ કરે. આ રીતે અફળનું ઓષ્ઠ કરનાર છે. જગતમાં છે ડોઈ આવો સાયન્ટીસ્ટ ? પ્રભુનું પુણ્ય એવું પ્રકૃષ્ટ કે-તેઓ જન-મતાંની સાથે જ ધન્દનું આસન ડોલે ! સામાન્ય ડેવળીમાં તેમ ન બને.

### આતીથેદેવળીથા ઉપકાર ન થદ શકે

ઈન્દ્રો આવીને ભક્તિનાં તમામ અપૂર્વ સાધનો ખડાં કરી હે, તે શું કામ ? જે કે-તત્ત્વથી તો પ્રભુના અતિશય બળે જ હોય છતાં સામાન્ય રીતે કહીએ કે—જગતના પ્રાણીએને આકર્મિબા. કોડા તે જોઈની દૂર દૂરથી આવે. લગવાનને જોયા પહેલાં ‘એ

તો છંદળજાગ્રે છે.' એમ કહેનાર પણ આવીને ગણુધર બને તે શાથી? અપૂર્વ દસ્ય જેવાથી ને? વાતચિત તો પછી કરી છે પણ જેતાં જ 'આ શિવ કે ખલા' વિગેરે તર્ક થયા. પછી અચ્યું કે-'ઓળખ્યા! ઓળખ્યા!! આ તો અહીંન' આ શાથી થયું? ડેવલી પણ તીર્થકેવળી તથા અતીર્થકેવળી એમ એ બેઠે છે. તેમાં અતીર્થ કેવળી લોકમાં તેવો ધર્મ ફેલાવી ન શકે. અતીર્થકેવળી કાં તો પ્રથમ તીર્થ સ્થપાયા પહેલાં હોય અગર (શ્રી સુવિધિનાથથી તીર્થવિચ્છેદ ગયેલું તેવા) તીર્થવિચ્છેદ સમયે અહિં મુનિધર્મ પ્રચલિત છે તો મુનિ પણ અહિં ઉપકાર કરી શકે છે. લંડન જાય તો મુનિને સાંભળે ડાખું? ત્યાં ધર્મ કેને જોઈએ છે? ત્યાં તો ઢીંગલાની વાતો જોઈએ છે. એ મુનિને સાંભળે? એ તો મુનિને પૂછે, 'વાંદરાની રસીનો પ્રયોગ તો કરી જેયા પણ હવે ભીજ ડાની રસી શોધવી?' ત્યાં મુનિ શું કરે! અતીર્થકેવળી પણ આ ન્યાયે ઉપકાર ન કરી શકે, કારણું—તીર્થ ન પ્રવર્તતું હોય ત્યારે વિચરતા તેઓને સાંભળનાર કોઈ ભાગે જ મળે. મુનિને મુનિ માને તેને મુનિ પણ ધર્મ કહે. પણ મુનિને છાપન લાખ બાવામાંના ગણે તેને મુનિ શું કરે? એ તો મુનિને કહે, 'તમે તો માગી ખાઓ છો! તમારાથી બેઠુત સારો બેઠુત! એતી કરે, પકવે ને ખાય!' ત્યાં મુનિએ ચૂપ જ થવાનું ને? એવા ગ્રાણીના આત્માની ઉત્તેવિ કેની રીતે કરી શકાય?

**પ્રશ્નઃ—**તીર્થ ન હોય ત્યારે કેવળી થાય તે થાના યોગે?

પૂર્વની આરાધનાના યોગે. સ્વયંભૂરમણું સમુદ્રમાં ભત્સ્ય, શ્રી જિનમૂર્તિના આકારનું માછલું જોઈને જાતિસમરણું પામી ધર્મ પામે છે. ત્યાં તેને ડાખે ઉપરેશ આપ્યો? કહો કે પૂર્વનો યોગ ત્યાં કામ કરે છે. વજસ્વામિએ ઘેડીઆમાં સાંભળ્યું, 'ધનગિરિ અત્યારે હોત તો મહેત્સવ કરત' આ સાંભળાને એ આથકર્પે

વજસ્વામિ કેવું સમજ્યા ? પૂર્વની આરાધનાના યોગે અરેખર  
(તત્ત્વ) સમજુ ગયા ને ?

**અપલક શું સમજે ? એમ ન માનતા !**

‘આલક શું સમજે ?’ એમ ન મનાય. સરખા પહેંચેખવાળા, સરખા દેખાવવાળી પાંચસે ખીંચો. બેગી કરો, ડાઇની પાસે બાળક જરો ? નહિ જ જાય; માતાને તુરત એણખી લેશો. હજ મોટો માણુસ દેખાવથી ભુલાવો જ્યાય, એકને બદલે ભીજુને ઘૈરી માતી લે, બ્રમ ખાઈ જાય, ભુલથાપ ખાઈ જાય, પણ બાલક ભૂલે ? ન જ ભૂલે. પૂર્વના સંસ્કાર છે. સો વિજ્ઞાનીઓને લેગા કરો તો ય બાળકને જે જ્ઞાન છે તે વિજ્ઞાનીઓ નહિ આપી શકે. બાલક જન્મતાં જ ચપચપ ધારે છે, ડેણે શીખયું ? ખાવાપીવાના, ધાવવાના, આ તમામ સંસ્કારો પૂર્વના છે ને ? જેમ આ સંસ્કારો સાથે આવે તેમ તરવાના સંસ્કાર પણ સેવ્યા હોય તો સાથે આવે જ ; કેમ ન આવે ? શ્રી વજસ્વામિને તરવાના સંસ્કાર પૂર્વના સાથે આવ્યા હતા. તેથી જ જન્મતાંની સાથે જ દીક્ષા લેવાના ઉપાય તરીકે તેમણે રોવાનું, રોઈને માતાને કંટાળો આપવાનું શકે ક્રયું. પંચાત્મન વર્ષનાં મા—આપ તેવા સંસ્કાર વિના ન સમજે અને સંસ્કાર લઈને આવેલું તરતનું જન્મેલું બાલક સમજે.

**સુનિ ખાવા જેવા ?**

અતીર્થ કેવલીથી પ્રાયઃ સ્વનો ઉપકાર થાય. પર ઉપકાર થવા સંબંધે તેઓના જ્ઞાનપ્રકાશને ખ્યોતના પ્રકાશની ઉપમા આપી છે. ખ્યોતના પ્રકારો લોંય પડેલા મોતી ન વીણ્યાય. એ પોતે તગતગ ઝર્ણી કરે. અતીર્થકેવલીને સામાજો તેવા જાણે અને માને તો ને ! યોગ્ય આત્માઓની બહુ જેરહાજરીમાં આ પૂર્ણુત્તમાને ડેણું સાંભળે ? સુનિને સુનિ માને એને સુનિ ઉપદેશ હે. ખાવા માને તેને શું કહે ?

**પ્રશ્નઃ**—બાવા જેવા જેણો મુનિને કહે તેની સામે કંઈ રહ્યો?

૬૧, કહી શકાય કે—“એ બાવા જેવા નથી. બાવાઓ માગવાની વૃત્તિવાળા હોય છે. મુનિઓ માગવામાં પાપ સમજે છે. મુનિઓને જીવાનું સ્વપર ઉપકાર માટે હોય છે, માંગી ખાવા હોતું નથી. આવા તો કહી હૈ, ‘શેરભર આટા, પાવઅર પૂપ, આધાશેર ગુડ, ધર હે છધર! ’ અને ન આપે તો ચૈસા માટે પણ નાગું કરે! જ્યારે મુનિ વહેરવા આવે, કોઈ કહે—મહારાજ!

અત્યારમાં? હજુ તો છોકરાં સૂતાં છે! મુનિ કહે, ‘ધર્મલાભ! ’ મનમાં સમજે હે બિચારો દારદી છે. ચોતાના આવકની આવી દશા માટે મુનિને દુઃખ થાય. મુનિ, ન મળ્યાનો એહ ન કરે પણ ગૃહરથને લાભ ન મળ્યો તેને અંગે દુઃખ ધરે. મુનિ અને ખાવામાં આ ફરક છે.

**બાલો લિંગ પદ્ધતિ ! માટે જ પ્રભાવના !**

અતીર્થકવલીનો જનસમૂહ ઉપર પ્રભાવ ન પડે. શ્રી જિનભર દેવને પ્રભાવ પડે. તીર્થકરોના કાળ જેવું બીજે કાળે જીવાનું પુણ્ય ન હોય. તીર્થકર દેવો મહાનું પુણ્યાનુંધી પુણ્યવંત હોય છે. તેણો અનુપમ અતિશયોવાળા હોય છે. બાલો લિંગ પદ્ધતિ ! બાલક આચારને જૂણે છે. લોછ કુતુહળ તરફ વળે છે. આથી તો દ્યંગ મહારાજ એક હળર યોજન ઉંચો ધ્વજ ઉભો કરે છે, કે— જેથી લોછ પ્રભુને જેવા ટેણે વળે ! એ ધર્મગરો જડો કોવો હશે ? તમે તો શ્રી જિનમૂર્તિને માનનારા છો ને ? છતાં રોજના દર્શનમાં અને આંગીને દિવસે દર્શનમાં, ઉત્સાહમાં ડેટલો ફરક હોય છે ? કહો છો ને ‘આજ તો હીરાની આંગી છે, ચાલો દર્શન કરવા ! ’ શું હીરાની આંગીથી ભગવાન ફરી ગયા ? ભગવાનને જેનારા જુદા, એની દષ્ટ હીરામાં ન હોય પણ હીરાને જ જેવા ટેવાપલાને તો ભગવાન એળખાવવા આંગી જ સમર્થ છે. તાત્પર્ય કે—આલજુવો

આકળમાળ જુએ છે. આંગી અગવાનને શ્રીમંત દેખાડવા માટે નથી, પણ અગવાનને એ દ્વારા ઓળખવા માટે છે. બાલજીવો હીરા વિગેરમાં રાચી રહ્યા છે, તેમને આત્મધર્મમાં લેડવા માટે આંગી છે. બાળજીવો પ્રથમ તો આંગીથી આક્ષ્યાઈને આવે, પછી એ આંગી ડાની છે તે જેવે અને કેમે પ્રલુને ઓળખે. વહુને જેવા આવનારને, પિયરીયાં કન્યાને ડેવી બખુની-ઠખુનીને દેખાડે છે? કન્યામાં ફેર ન હોય. પણ ભલકો કરે એટલે જેનારને લાગે, ‘નણું કન્યા તો પદમણું! ’ કહેવત પણ છે કે-

‘એક નૂર આહી, હજાર નૂર કૃપાં, લાખ નૂર દાપડીએ,  
 હેડ નૂર નખરાં! ’ દુર દૂરની અગાન હુતીઓને ગ્રાન તરફ એંચી  
 લાવવા ચાર હજાર ગાઉ ઉંચો ધળગરો ઘન્દમહારાજ લાવે છે!  
 ક્રાડીને હાથીની મોટાઈ ન સમજય માટે હાથી મોટો નથી?  
 જ-માલિષેક વખતે જોજનના નાળવાવાળા હૈવી કંગશો દેવો હાજર  
 કરે. આ તમામ શ્રી તીર્થંકર દેવના સર્વેપરિ પુષ્યથી થાય છે.  
 તીર્થંકર દેવ કોઈને નોતરં નથી આપતા, પત્રિકા નથી કાઢતા,  
 ‘અમે આવવાના છીએ, તૈયારી કરજે, ’ એમ પ્રથમથી પ્રોઆમ  
 જહેર નથી કરતા ! ઈન્દ્રો રિગેર પોતાની અક્ષિયથી આવે હાડ  
 ખડો કરે છે. દિવ્ય વાળંનો વગાડે છે. ધર્મની એ રીતે પ્રભાવના  
 કરે છે. છોકરો પરણે, વહુ ધરે આવવાની, સમ્યગુદ્ધિ આત્મા તો  
 ક્ષમને ઝાની હુતીઓના પાયાર્થ માને છતાંય ઢોલ વગાડે ને ? એ  
 વહુમાંથી ય ગુરુ ગયા ? અહિં જો ઇપીએ અને શ્રીકૃણની પ્રભાવના  
 હોય તો કાચીપોચી દ્વારા હોય તો પડી જય એટલી સંખ્યા  
 શ્રોતાની જમે ! એ લેવા આવનાર પાંચ-દશ મિનિટ પણ  
 સાંભળે ને ? આવીરે તરત પાછો વળો પ્રભાવના લેશો ? પ્રભાવના  
 કરનારે તો વહેંચનારને કહી જ દેવાનું કે-અંદર આવે ને તુરત  
 પાછો વળે તો પણ પ્રભાવના રોકોક કર જ હૈવી. અંદર

આવનાર ડેટલું બેઠો એ પ્રભાવકે કાળજી રાખવાની ન હોય. જ્ઞાન તરફ વળેલી જનતાને ધર્મ તરફ સહેલાઈથી વાળનારી પ્રભાવના છે. આથી જ કણું છે ડે-આવનાવાળો ચોતે જ તરે પરંતુ પ્રભાવનાવાળો તરે અને તારે. ‘પ્રકૃષ્ટ ભાવનેતિ પ્રમાવના’ પ્રમાવના કરવાવાળો ભાવનાવાળો કરતાં ભારી ઉચ્ચય છે.

આવી પ્રભાવના હોય લાં રોહિણીયા જેવો ચોર તરી જાય. બાપે તો વીરનું વચ્ચન સાંભળવાની ના કહેલી, પિતુભક્ત રોહિણીયો પણ કાને આંગળા દર્ઢિને પસાર થાય છે. પરંતુ દૈવીયોગે કાંટા વાગે છે, અને આંગળીએ છૂટી જાય છે. દેવોનું વર્ણન કાનમાં પડે છે. એ વચ્ચનથી તે અભયકુમારના પંજમાંથી બચે છે! એને થાય છે ડે-જે પ્રક્ષુના આટલા જ વચ્ચે આવો બગાવ કર્યો તે પ્રક્ષુનાં વચ્ચોનો જિંદગીભર સંભળાય અને સાંભળ્યા મુજબ વર્તાય તો લાભમાં શું કમીના રહે? આવું વિચારી તરત દીક્ષા લે છે! આ શાયી બને? પ્રમાવનાથી. બાળજીને ભાવના દેખાતી નથી, પ્રભાવના દેખાય છે. અને તેથી તેઓ પ્રથમ તો પ્રભાવના તરફ હોટ હે છે, પરંતુ પછીથી એ જ પ્રભાવનાના પ્રતાપે ભાવનાથી વાસિત થઈ જાય છે, અને ચારિત્રનો પણ રવીકાર કરે છે.

એકેન્દ્રિયની ય આ દર્શા, ત્યાં પ ચેન્દ્રિયની  
દ્યાની વાત જુઠી ઠરે છે

આપણૂં દેવ ધૂર્યા વગરના, સ્થાનાદિની યોજના કે ગ્રોઆમ કશું યે નહિ! ઉપદ્રવ થવાના છે માટે અકિંચની ઈંદ્ર સહાયાર્થી રહેવાની માગણી કરે, પરંતુ પ્રક્ષુ શું કહે છે? ‘ડેઝ તીર્થ’ કરે કાઈની સહાયથી મોક્ષ મેળવ્યો નથી, મેળવતા નથી, મેળવશો નહિ’ એમ જ ને? આવા નિરાગી પ્રક્ષુએ આત્માની ઉત્તરિના ઉપાયો ખતાબ્યા છે. આત્માના આવા વૈઘ શોભા ન મળે. પરમ પુરુષોદયે જ પરમાય, શરીરના વૈઘો કહે કે વ્યાધિ અયંકર ‘કૃપ’ છે. પણ એની

દ્વા ? કહી હે કે અસાધ્ય છે. આત્માના આ વૈઘ દર્શને બયંકર કલા ખણી તેનો ઉપાય પણ અમોદ જીતાવે. આવા વૈઘો બહુ જ ચોથ. વળ્ણ તેઓ જ્યાં લાં અને જ્યારે ત્યારે ન મળે કાયડો છે કે-એક સર્પિણી કાલમાં ચોવીશ જ થાય. આખા કાલચકમાં એટલે વીશકોડાડોડી સાગરોપમ જેટલા સમયમાં એ જ ચોવીશી થાય. આવા તારકાને પામીને તરવાનો સમય આપણે માટે એ આખા ય કાલચકમાં માત્ર એ જ ડોડાડોડી સાગરોપમ જેટલો છે ! અનાર ડોડાડોડી સાગરોપમમાં તરવાનું કાંઈ સાધન જ નહિ ! કાઈ ખણુંધોરી જ નહિ ! આ એ ડોડાડોડી સાગરોપમના કાળમાં આત્મા જાગે તો જ ઉદ્ધાર થાય ન જાગે તો રખ્યી જાય. માનવ-જિંદગી જ દ્યાદાન-તે દુર્લભ છે, તો પણી આત્મી સામગ્રીની શી વાત ! માનવજીવન મોંધું છે તે મજ્યું, પરંતુ પ્રભુના શક્તિનસમયમાં ન સધાય તો કેવું કમભાગ્ય ? આત્મા જાય પાણો તિર્યંચ કે નરકમાં. દુઃખી દુઃખી થઈ જાય. એક વરતુ પ્રયાલમાં લ્યોઃ હાથ નહિ, પગ નહિ, કાન નહિ, આંખ નહિ, નાક નર્ણ. માનો ને લોઢાપુત્ર. એવા નિરાધાર અને અશરષુને કાઈ કરડી ખાય એ કેવો ? એકનિદ્રયની શું દ્યા છે ? એ જ ને ? લોઢાપુત્ર તો મનુષ્ય. મનુષ્યમાં એ પુષ્ય છે કે-જગતના રાજથી કે માનવની પણ રાહત પામે. એકનિદ્રયની કંઈ દ્યા ? છે એને કાઈની ય રાહત ? જાડ એકનિદ્રય છે ને ? એક પગે ઉલ્લં છે, માથે તડકો છે, તથા કરે છે; પ્રગાસી તેની છાયામાં પરિશ્રમ ઉતારે છે, બદ્ધલામાં ‘ઉંચે જેતાં ફળ જોયું’ કે-પત્થર મારે છે. અધર્મના હાથે એકનિદ્રયની આ દ્યા છે ! કાઈ કાળ તોડે, કાઈ પાંદડાં કરડે ! ડરી તોડે, કાકડી તોડે. કહે કે-‘ કહું છે, મજેની છે.’ કહીને લય લય કરડી ખાય. જીતા જીવને આમ કરડી ખાતો સતો કંપે જ નહિ. આ શું માનવતા છે ? આ આત્માની ઉત્તરિનો ઉપાય છે ? આત્માની ઉત્તરતિ એવા

અશ્વરણુને ઉગારવાની ભાવના આવશે ત્યારે જ થશે. એકેન્દ્રિયને ય આ દશામાં મૂકુનારા પંચેન્દ્રિયમાં પણ માત્ર માનવીનો જ ઉદ્ધાર કરવાની વાતો કરવામાં ય જુડા છે, તે ખીના પણ આ ઉપરથી સ્થષ્ટ સમજ શક્યા હશે? એવા તરફથી બતાવાતા ઉપાયો આત્માની ઉત્તરિના હોતા નથી પણ અવનતિના હોય છે.

### ખર્મ માનવીને જ કહેવામાં આવ્યો

ખર્મ વિહેણેણું માનવી નિરાધાર એવા એકેન્દ્રિયને ય હણ્ણી-ને આવું પાપ કરે, પાપના બચાવો કરે અને ઉપરથી કહે કે- ‘કોના માટે કયું છે?’ પરંતુ એને પૂછું જોઈએ કે-કણે, તારા ‘બા’ એ કર્યું છે? અને તો પછી તને પણ કોઈએ કોઈના માટે કર્યો હોવાથી તને કોઈ કરી ખાય તેમાં વાંચો નથી ને? લાં તો કંપ વધ્યો છે? કેમ બલા? હું સૌને ખાડું, મને કોઈ ન અહે, એમ ને? પરંતુ કુદરત નહિ છોડે. તું સૌને ખાય ત્યાં સુધી તું ખવાવાનો જ, ચવાવાનો જ. વાસીમાં લાળીયા જીવ આવે, શાનીએ વાસી ખાવાની ના કહી છતાં ખાય. કહે કે-‘એમાં શું?’ રાત્રે સો નંબરનો મોટા દીક્ષિઃ કરીને ખાય, પરંતુ ખ્યાલ નથી કે દીવો તો જીવોનું નોતરં છે. ત્યાં જીવો દીવાને યોગે દૂર દૂરથી ચાલ્યા આવે. દીવાને હેઠે. એ ચહિરન્દિય છે ને? આવી આવીને આણ્ણામાં પડે અને ટપોટપ મરે, તે તું ખાય! ઉપરથી દ્વીપ કરે-વીજળાની લાઈટમાં ‘અધું ય હેખાય છે! પણ ઉડતા અને આણ્ણામાં પડતા જીવો કેમ નથી હેખાતા?’ મોતી કેમ નથી પરો-વાતાં? ગમે તેવા પાવરનો જોગે ટાંગે તો ય સ્ર્યંના પ્રકાશ સાથે આવે? શાંકો જેની સાઢું ના કહે તેની જમાના અને વીટા-ભીનના નામે ધૂટ બતાવે! આવા ખામર આત્માની ઉત્તરિ શી રીતે ખાય? ‘આર્દ્રામાં કરી કેમ ના ખવાય? કહું કરીમાં કચાંથી જીવાં? કંદમુળમાં શું હોય?’ આમ કહે. આ બધા ચાળા શાથી?

કહે કે માનવ ભરીને રાક્ષસ બની ગયા તેથી. પણું ઓ પણું રાત્રે ખાતા નથી. પક્ષીઓ પણું રાત્રે એથી નિવર્ત્તા છે. કાગડો ય રાત્રે જર્ખી જાય, સવારે ઉઠી, પ્રથમ જળાશયમાં જઈ દ્વિસના પાપથી પવિત્ર થાઈ આવે છે. જ્યારે માનવી તો ઉંચા જીવનવાળો છતાં ય હજુ પાપનું રનાન કરવા તલસતો નથી ! એણે નબળા-પાંગળા-ઓની દ્વા-રક્ષા કરવી જોઈએ કે તેમને કરડી ભરડી જવાના સિદ્ધાતો ધડવા જોઈએ ? અલક્ષ્ય અનંતકાયને કરડી ખાવાનું કહે અને માનવી સિવાયના બીજાને મારી જ નાખવાનું કહે એ આનવો છે ? માનવીપણું એ ડેવી કિંમતી જિંદગી છે ? પાંચમી ગતિ અહિંથી મળે, સુક્રિત અહિંથી પમાય, દેવો માટે બેજ અતિ. દેવ મરી દેવ ન થાય, નરકે ન જાય કાં એકનિદ્રય તિર્યાંથાય, કાં મનુષ્ય થાય. મનુષ્ય તમામ ગતિમાં જાય. સદ્ગુપ્યોગ કરે તો સુક્રિત મેળવે અને દુર્ગુપ્યોગ કરે તો નરક અથવા ઢોર થાય. ઢોર ધર્મ કરી શકતા નથી, નારકી ધર્મ કરી શકતા નથી. તેમજ દેવ ધર્મ કરી શકતા નથી. માનવી જ ધર્મ કરી શકે તેમ છે. એ બીજાને મારી જ નાખવાનો ધર્ઘા જોલે તો એની ગતિ કઈ ? માટે તો લગવાને માનવીને ધર્મ કલ્યો. આત્માની ઉત્તરિના ઉપાયો પ્રલુબો માનવીને બંતાયા. તારકની પ્રવૃત્તિ બધા ય જીવાના કલ્યાણનું કારણ છે. પણ તે ઇણે કોને ? એકનિદ્રયથી માંડી પંચેન્દ્રય તિર્યાંને ? નારકને ? દેવોને ? નહિ. કારણ કે-તેઓને તથાવિધ સામગ્રીનો અભાવ છે. ધર્મ-સામગ્રીથી ભરપુર માનવી જ હોવાથી ધર્મ માનવીને ભારી ઇણે.

**આત્માની ઉત્તરિના ઉપાયો છે, દાન-શીક્ષણ-તપ અને ભાવ**

પ્રલુબો આત્માની ઉત્તરિના ચાર ઉપાયો કલ્યાઃ દાન, શીક્ષ, તપ અને ભાવ. આ ચાર ઇપે ધર્મ કલ્યો. આ ચારે ય ધર્મો અલિન્ન છે. પરસપર સંદૂલિત છે, તથાપિ કલિકાલ સર્વ-જી

ભગવાને કલ્પના ધરી કે-ચાર પ્રકારનો ધર્મ કહેવા માટે જાણે  
ભગવાન ચાર રૂપે થયા ન હોય એમ માતું શું. અહિ 'મન્યે'  
હિયાપદ વાપરેલ છે. એથી પ્રભુ ચાર રૂપે નથી થયા, પરંતુ  
ઉત્ત્રેક્ષાલંકારથી એમ કહે છે. 'ચંદ્રમુખી બાળા' તેથી  
તેનું મુખ ચંદ્ર સદશ હોતું નથી. તાત્પર્ય કે-પ્રભુએ એક  
સાથે ચારે ધર્મ કહેવા જાણે ચાર રૂપ ન કર્યાં હોય! એવો  
કાલ્પનિક અલંકાર છે, મૂર્તિને ન માનનારા બાઈચો પણ સમ-  
વસરણુમાં પ્રભુનાં ચાર રૂપ તો માનેજ છે! મૂલ રૂપ તો  
એકજ છે, બાકીનાં તો કૃત્રિમ રૂપો છે, છતાં અતિશય એવો  
કે-દરેક દિશામાં એઠેલાએ. એનેજ મૂલરૂપ માને. ધર્મ ચાર  
પ્રકારનો કહો છે, તેથી તે પરસ્પર બિન્નજ છે એમ નથી.  
ભાવના વિના દાન, શીયલ, તપતું મૂલ્ય શું? તેમ દરેકમાં સમ-  
જવું, પ્રમાણુમાં ન્યૂનાધિક્ય હોય.

### દાનધર્મ પહેલો શાથી ?

આમ છતાં ચાર પ્રકારના આ ધર્મમાં દાનધર્મને પહેલો  
નંબર કેમ આપો? આ ચાર પ્રકારનો ધર્મ માનવી કરી શકે  
તેમ છે. આ ધર્મ વગરનો માનવી આત્માની ઉભ્રતિ તો કરી  
શકતો જ નથી. પરંતુ આપણે જોઈ ગયા તેમ માનવ ન રહેતાં  
રાક્ષસ અની જરૂર નીચામાં નીચી ગતિએ ચાલ્યો જય છે. માનવી  
સાતભી નરક સુધી જય છે. તિર્યંચો તો અકામ નિર્જરાદ્ધિ  
ઉંચા આવે છે. દૈવતાની વધારે સંખ્યા તિર્યંચો પૂરે છે. સર્વતઃ  
પરાધીન એવા તિર્યંચોને તો સહન જ કરવાનું છે ને? 'કોઈ  
કાપે, કોઈ મારે, કોઈ તાડના કરે, પાણી પાનાર કોઈક નીકળે,  
આખલો જેને કહેવાય તે ય નાના છોડરાના સાંઠીકડાથી ભાગવા  
માડું.' એને કંધાં દળતર વાળવું છે! સ્વાધીન માત્ર માનવી.  
એ માનવી જે ધર્મ અંકુશનો રવીકાર ન કરે તો પરાધીન

તિર્યંચોને પણ કેવી કારણી રીતે હશે? અંતે નીચે જ ગયડે ને? આઠલો હંચો આવ્યા પછી તે ન ગયડે માટે જ પ્રભુએ માનવીને દાન, શીખ, તપ તથા લાવ, આ ચાર આત્માની ઉત્તેવા ઉપાયો કહ્યા. તે ચારમાં પણ દાનધર્મ સહૃથી પહેલો કહ્યો! કેમ? ભાવનાવાળા હજુ મળે (માત્ર વાતોમાં શું વાંધો?), શીખ પાળ-નારા મળે (ક્યાં કાંઈ લેવું હેવું છે?), તપ કરનારા ય મળે (દાણું બચે ને?). એ ત્રણે ય ધર્મમાં કોઈને કાંઈ આપી હેવાતું નથી. કોઈને આપી હેવું તે આકર્ષણ છે. દાનધર્મમાં આપવું પડે છે. તેમાં ‘લઉ લઉ’ ની અનાહિતી લાવના લુંસી નાખીને ‘દઉં દઉં’ નાં દર્શન કરાવવાં પડે છે!

ચારે ધર્મમાં દાનધર્મ, આથી મોખરે છે. એ ધર્મ આકરો છે તેમ સહેલો પણ છે. તેમાં શીખલ પાળવું પડતું નથી, ભૂષ્યા રહેવું પડતું નથી, ભાવના શોધવા જવાતું નથી. ભાવના ન હોય તો એ દાનધર્મ આકરો પણ છે. દાનમાં તો રોકડું ચૂકવાતું છે, કાઢીને હેવાતું છે. ત્યાગધર્મનાં મંડાણું અહિંથી મંડાય છે. ત્યાગધર્મના સાચા પાડો અહિંથી પદ્ધવા શરૂ થાય છે. પહેલો એકડો કરવો કટલો કઠીન છે તે બાણેલાના અનુભવની વાત છે. ભગવાન શ્રી ઋષભહેવની સાથે દીક્ષા લેનારા ચાર હજાર ચાલી ગયા. તાપસ થયા. શાથી? શીખલ નહોતું? તપ નહોતું? ભાવના ન હતી? એ તમામ હતું, તો કેમ ગયા? કહો કે તે વખતે એક દાનધર્મ જ ન હતો. મુનિને દાન હેનાર કોઈ ન હતો. દાન હેનારથી તો તીર્થ ટક. આખા યે તીર્થને ટકાવનાર દાનધર્મ છે. માટે દાનધર્મ અગ્રપદે છે. મુનિ પણ ત્યાં નિહાર કરે કે-જ્યાં દાન હોય. દાનનાં દાર બંધ હોય ત્યાં મુનિ શી રીતે જય? દેરાસર-આગમ, એ તો મુંગાં તીર્થ છે. મુનિ જ એક બોલતું તીર્થ છે. દેરાસર વિગરને તીર્થ તરીક ઓળખાવનાર જવતું તીર્થ મુનિ છે. સાત ય

શ્રેષ્ઠાને જીવતાં રાખે મુનિ. મુનિ કુક્ષિ સંઅલ હોય છે. દેહથી ધર્મ છે માટે દેહને આધાર આપે. મુનિથી ધર્મ ટકે. મુનિ દાનધર્મથી ટકે. દાતા આ લાભ ઉડાવે છે. ચાર પ્રકારના ધર્મમાં આથી દાનધર્મ પહેલો કર્યો છે. વળી ગૃહસ્થીને માટે વર્તનની દાખિઓ ચારેયમાં સહેલો આ દાનધર્મ જ છે. ગૃહસ્થીને ઉત્કટ શીલ ન પણાય-તપ ન પણાય-ભાવના નભાવી શકાય; પરંતુ દાત તો સહેલે અને ધારે તેટલું આપી શકાય. મુનિ, ધર્મ માટે ઝરે. ધર્મ માટે તેમણે જીવન સમયું છે. ધરાવાર તન્યાં છે. તેની પાસેથી ધર્મ લેવા દાતા મુનિને દાન આપે. મુનિ નિર્યાંથ હોય છે. વિહાર કરતા ઝરે. ‘કોણ ટીકોટ કદાની આપશે કે કોણ રોટલા આપશે?’ એવી ચિંતા મુનિને ન હોય. ભાવના પણ ખૌખ પારીને ધરે જવાની ન હોય. આ મુનિવરો ઇપી પાત્રમાં દાન તે સુપાત્રદાન. મુનિવરોનું જીવન સ્વયર ઉપકારાર્થ જ છે. વિહાર કરતા આવે, એમને દાતાએ આધાર આપ્યો-પરિશ્રમ ઉત્તેરી-ભૂખ નાઠી. લોડા વ્યાખ્યાનની માગણી કરે કે-તરત તૈયાર! પારાવાર ધર્મ આપે. એવા સત્પાત્રમાં દાન યોજે એના આત્માની ઉજ્જ્વલિને અટકાવવા કોણ સમર્થ છે? આવે દાનધર્મ કરનાર રબારીનો બાળક પણ શાલિલદ્ર બની અપવર્ગ સાધે છે.

મુનિથી આવક કે આવકથી મુનિ?

‘દુનીયાનું’ વ્યવહાર શિક્ષણ આપવા છોડકરા માટે શિક્ષક રાખો છો. કલાકના વીશ આપો છો! મુનિ દેશનાનો ચાર્જ લે છે છે? મુનિ પાસેથી મેળવો છો કેટલું અને મુનિને દૂષ-દી કેટલી કિંમતનાં આપો છો? મુનિએ માટે કેટલાકો કહે છે, ‘રોટલા તો અમે આપીએ છીએ.’. અલ્યા! ઉપકારી મુનિરાજને રોટલા “તને જ કોના પ્રતાપે મળે છે, એ ખબર વિનાનો.” તું શું આપતો હોતો? પૂર્વભાવે ગુરુથી મળેલ ધર્મના પ્રતાપે જ તું આજે સુખે

રોટલા ખાય છે, એ તને ખ્યાલમાં કેમ નથી આવતું? દીકરો માતાને કહે, 'હું પાળું છું' એ મૂર્ખ નથી? માઝે દૂંઘો દીધો હોત તો નામદાર હોત કચાંથી? માતાની એ આ ભવની પણ દ્વારા આ મૂર્ખની યાદ આવતી નથી, તો ગુરુએ કરેલ પરલબ્ધની દ્વારા તો યાદ આવે જ કચાંથી? ધાવતાં ધાવતાં કરડી જતો, તો ય માતા પંપાળતી. પાણ્યો, મોટા કર્યો, એ માતાને પાળનાર તું ડાણુ? પરલબ્ધ આડો-તેડો ચાલતો તો પણ ગુરુએ પંપાળીને જેને માનવ બનાવ્યો છે તે માનવી આજે 'ગુરુને અમે રોડલા આપીએ છીએ' એમ કહે તે 'માતાને હું પાળું છું' એમ કહેનાર મૂર્ખ જેવા છે. પેલો જેમ 'માતાથી જ પોતે છે' એ ભૂલી જય છે તેમ અહિ અજ્ઞાની જન, 'મુનિથી જ પોતે છે' એ વાત સદંતર ભૂલી જય છે. અગવાન ઋડલબહેવે તીર્થ સ્થાયું. સાધુ, સાધ્યી, આવક, આવિકા સંધ સ્થાયો. તે પહેલાં આવક કચાં હતા? આવકને કર્યા ડાણુ? ખ્યાલમાં લો. આત્માની ઉજ્જ્વિના ઘેયવાળો આવક તો જ એ કે-'મુનિથી હું છું, મારે આંગણે મુનિ કચાંથી?'

**ક્રાથળીએ ઉધરાવનારા ઉપકાર કે ઉજ્જ્વિ કરી શકતા નથી**

આપણે જોઈ ગયા કે-તારકે દાનધર્મ મહાન્ હોવાથી જ સૌથી પ્રથમ કલ્યો છે. કલ્યાણની જડ એ છે. એથી સંસારરસિક માનવીએનો ફદ્યપલટો પ્રગટ એળાખાય છે, 'લઉં લઉં'માંથી 'દઉં દઉં' દેખા હે છે. માટે જ આત્માની ઉજ્જ્વિની ઈચ્છાવાળા સહુ કોઈએ દાન કરવું એ પ્રથમ જરૂરી છે. માનવતાનાં મૂલ્યાંકન દાનથી શરૂ થાય છે. ધર્મનો મર્મ સમજો. શાસ વિના જીવાય નહિ તેમ ધર્મ વિના જીવાય નહિ. અજ વિના દેહનું પણ તેમ છે. ધર્મ દેહથી થઈ શકતો હોવાથી દેહને આહાર-પાણીની જરૂર માટે તે કરવા પડે. આ શુદ્ધ સમ્યગ્દાષ્ટને હોય. 'બધું' આવા

માટે કર્યું છે.' એમ ડોષુ બોલે? ડેક્ટર કહે-મગના પાણી ઉપર રહેવાનું, તો કખૂલ! મારે તે શી આપીને પણ કહે તે કખૂલ! કૃતા આ તારકે અતાલું તે જ કખૂલ નહિ? આવા આત્માની ઉત્તરિ કેમ થાય? અહિ હવાના ઢોગદા નથી લેવાતા. એકનિદ્રયથી માંડીને તિર્યાંચ પંચેનિદ્રય સુધીના 'તમે જીવાડો તો જીવે તેવા' પ્રાણીની દ્વારા કરવાની તો સાફ ના કહેવાય છે, અને અરાડા દ્વારા ભરાઈ રહ્યા છે! આ દ્વારા છે? માનવ ઝંખંધીની દ્વારાની વાતો આખત પણ કેવલ બંગાલ રાહન આહિના નામે લાઘો એકઠા થઈ જય તો ધાર્યો હાથ મરાય એવું તરી નથી આવતું? ડોષુ ડેટલા એકઠાં કરી ડોને કચારે અને ડેવી રીતે કથાં ખેણ્યાડયા? છે સંતોષજનક ખુલાસા? માનવાની પણ આ ડેવી દ્વારા? સ્વાર્થી એવા અજ્ઞાન જનોથી દ્વારા પળાતી કે પળાવાતી નથી. એવા ઉપકારીઓથી ડાઈનાય આત્માની ઉત્તરિ થઈ શકતી નથી. જગતથી પર એવા તીર્થ્યકર હેવો તથા તેના થાસનને સમર્પિત થયેલા નિર્ભાયા જેવો ઉપકાર સ્વાર્થીઓ કરી શકે? ન ભૂતો ન ભવિષ્યતિ. સંસારીઓને ઝોળી ભરવાની વાત પ્રધાન-પદે હોય છે. પછી બલે ભારતના આયમતા ન જણ્યાવાને લીધે ઉગતા સૂર્ય દેખાતા હોય. કહેવા લાગી જય કે અમુક હેવ કે હેવીઓ કહેવાય છે. પણ જ્યાલમાં લેવાનું હે 'બસ! ડાયળો લાવો' ની વાત સિવાય લાં આત્માની ઉત્તરિની વાત છે?

### માનવ ધર્માંકિત જોઈએ

ધર્મનો મર્મ સમજો. ગ્યાનીએ તત્ત્વ કહ્યું તે સમજો. જગત-માત્રના નાનાથી મોટા તમામ જીવોને તમે જીવવા ધો, અને જીવો. એના જેવી બીજી આત્માની ઉત્તરિ નથી. તેમ ન થઈ શકે તેમ હોય એવા અનિવાર્ય સંયોગોમાં રડો. સમ્યગ્રદ્ધર્થન આ છે. ન જીવકે ખાયપીએ-અધ્યું કરે; પણ માને કે આ સહકાર્ય નથી. મને

આ એકનિદ્રાહિ અશરણુ જ્વોને કરડી ખાવા-પીવાનો હુક નથી. દુનીઓમાં શું ચાલી રહ્યું છે? વિપરીત વ્યવહાર નિરાધારને કરડી ખાવા, ગરીબ પાસે વેઠ લેવી, સોગુણું કામ લેવું, અસહાય એવી વિધવા બહેનને હડધૂત કરવી, વાછરડાને આંચળે લાવી ‘જ્યાં ગાય દૂંખ લાવે કે’ ખસેડી દેવો, વેઠીએ ગજ ઉપરાંત વેઠ ન કરે તો ઉપરથી માર કાં સન! માનવમાં દેખાતી આ માનવતા છે કે પાશવતા? આ પાશવતા શાથી? ધર્મવિહિણું જીવન હોવાથી. આથી નકી છે કે-ધર્મ જ માનવીને ઉત્ત્રત બનાવે છે, અને તેથી આત્માની ઉત્ત્રત ઈર્ઝનારે ઇરજાત ધર્માંકિત બનવું જોઈએ. રાજ તે દર્શનીય હોય કે લયલર્યો હોય?

યુધિષ્ઠિર રાજએ દાનધર્મનો સ્વીકાર કર્યો. બીજું ન થાય પણ આ તો થાયને! યાચકોમાં દઢેરા ગીયાવ્યો. એક પ્રફર-દથી ૧૨ ને યાચક આવશે, તેની ને ધર્મચા હશે તે મુજબ યુધિષ્ઠિર રાજ દાન આપશે. યાચક આવવા લાગ્યા અને ધર્મરાજ યાચકોની જરૂરીઓાત મુજબ દાન આપવા લાગ્યા. દાન હેતાં વર્ષો વિતી ગયાં. યાચક ધર્મી બની ગયા. દાતા ઉત્ત્રર હોય તાં યાચક ધર્મી થાય. એ યાચક બીજાને યાચે નહિ, વધારે લે નહિ, કેમકે જોઈશ લારે ભળવાની ખાત્રી છે. પચ્ચીશ જોઈતા હોય તાં ત્રીજી દેવાય એ યાચક શું કામ ઉતાવળો, લોભીયો કે સંગ્રહખોર થાય? પ્રભાવના કરનાર આવા જોઈએ. ખોએ ઘે. લેનાર ખંચાય એમું ઘ એ કૃપણુ થાય એટલે લેનાર એકને બદલે બીજી વાર ધૂસીને લેવાની લાવનાવાળો થાય. દાતાની ઉદારતાથી લેનારમાં નીતિ, ન્યાય, ધર્મ પેદા થાય. એક બાલખુને આવતી કાલે કન્યાનું લગ્ન હતું. આગલે દિવસે યુધિષ્ઠિર પાસે યાવવા ગયો. પણ જરા મોડું થયું. દાનશાળા બંધ થઈ ગઈ. સિંહદ્વારે બેઠેલા બીમસેને બાલખુને ધર્મ-રાજ પાસે જવા દીધ્યો. જ્યાં દેવાનું જ હતું ત્યાં લેવા આવનારને.

ભય શો ? આજે ગવર્નર કે વાઈસરોયને ભૂતમૂલામણીથી ડફામાં પસાર થવાનું હોય છે. ચોકીદારો પોતાના, પણ તેને એ અવળા મુજે ઉભા રહેવાનું : એન્જિન તરફ નહિ જોવાનું : જુએ તો શ્રુ ! કાધથી આરી ઉધાડી ન રખાયા : રાખે તો શ્રુ ! આ ભય શાથી ? પોતાને માટે ભયો જ ઉભા કર્યા હોવાનું એ પ્રતિક છે. પ્રથમ તો રાજ નીકળે, લોકો દર્શાન માટે ઉમટે, માર્ગમાં લાઈનિઅંડ હાથ જોડીને ઉભા રહે ! કારણું ? રાજ ધર્માધિ, ન્યાયી, દાતા, પ્રલાને પુત્રરવ પાળનારા હતા. રાજ આમ આત્મવદ્ધી હોવાથી ભય વગરનો હોય, પ્રસન મુદ્રાવાળો. હોય, અને ધોડા પર, ધોડાગાડીમાં કે પગપાળા પણ આરતે કદમ ચાલનારો હોય. દર્શાનીય હોય. આગળ ધુંબાડો પાછળ ધુંબાડો એવા ચાવતાંતી સાથે માલિકને જ 'કૃટ-કૃટ' કહેવા માંડનારાં મોતકાર વાહનોથી વેગળો. હોય અને દાતા હોય. આથી જ રાજ પણ 'રાજયશ્રી નરકશ્રી'નું સૂત ઘોડું પાડી શકતા. અર્થાત હેવ થતા.

નગારાં વગાડયાં ! શાનાં નગારાં ?

ભીમસેને તો આલણુને ધર્મરાજના નિવાસ આણી આગળ વધવા દીધે, પણ ચોકીમાં હતા ચારે ભાઈ. આણુવળી અર્જુન, જેષી સહદેવ, વરણુગીએ નિકુલ તથા અલમસન ભીમસેન. ભીમ આમ તો મોટા, પણ ધૂતી. તે સૌથી મોખરે. આલણુ આગળ ગયો. નિકુલે તેને સાંલળીને આવતી કાલે આવવાનું કર્યું. દાન આપવાના ૬ થી ૧૨ ના નિયમના બંધન આગળ આલણુ બિચારો લાગ્યાર બન્યો. નિકુલજ આમ નિયમમાં ગયા, જારે ભીમસેન 'દાન નહિ મળવાથી આલણુને થતા દર્દના ઉકલ ૩૫' રહસ્યમાં ગયા. પાછા ઇરેલા બિન આલણુને ભીમસેનજીએ ઓદાય્યો. પૂછ્યું, બિન કેમ ? આલણુ કર્યું, 'મારા કર્મની કઠણ્યાઈ, હું મોડો થયો, અઆગીએ, કાલે કન્યાકળ જરો, મારું

નાક કપાશો.' ખાલણુંને ભીજે દાન મળે એમ હતું, પણ યુધિષ્ઠિર વિના ભીજને યાચવા ઈચ્છિતો નથી. ભીમસેને કહ્યું, 'ભાઈ, અહિં ક્ષણુંવાર થોબ. શાંતિથી બેસ.' ખાલણુંને વહાલથી બેસાડી ભીમ-સેનજીએ તો ડેલીમાં પડેલાં યુદ્ધનાં નગારાં ધડીમધીમ-ધડીમધીમ વગાડવા જ માંઝાં, જેરથી દીધે જ રાખ્યું. એ હેખાવથી હતાં યુદ્ધનાં નગારાં; પરંતુ તરવથી હતાં પરની પીડાથી પીડિત થવા સ્વરૂપ આત્માની ઉત્તરિનાં દુદુંભિઃ અકાળે યુદ્ધ-નગારના ગડ-ગડાટથી આખી નગરીમાં ડેલાહલ મચ્યો. વદ્ધાદાર માનરીઓ શાખથી સજજ થઈ ઉલીએ ટોળે વજ્યા. હણુહણુટ કરતાં યુદ્ધ-રસિક અશ્વો ભીલા ઉપેડીને તથા વૈરીને મદ ઉતારવા તથસી રહેલા મહોન્મત હાથીઓ આલાન સ્તંભો ઉપેડીને પણ સિંહદાર પાસે યુદ્ધની વાટ જેતા આવી ઉલા. સુલેટાનાં શાખાસ્થો ખણુ-ખણુટ ગાજવા લાગ્યાં. ઘુમી એ કે-આમ છતાં ધર્મરાજના પેણું પાણી પણ હાલતું નથી! એ કાંઈ કાપુરુષ છે? સિંહ જેવા પુરુષ ક્રેષ્ટ છે. સિંહને ગોળી વાગી :હોય, શરીરમાં આરપાર ઉતીરી ગઈ હોય તો ય આખી ડેક ફેરીને ન જુયો. ડેક વાંકી કર્યા વિના ટેઢી આંખે જરાક પાછી નજરું કરે. એને રહેવામાં આવે છે 'સિંહાવદોકન.' તેમ જ આ અણુંધાર્યાં ઉદ્કાપાતથી અદ્વય અકળાયા વિના ધર્મરાજને અજ્ઞુંનને શાંત હૃકમ કર્યો: 'ભાઈ! જે તો ખરો. આ અચાનક યુદ્ધનાં નગારાં ડેમ વાંગ્યા? શું આ ડેલાહલ?' અજ્ઞુંને સહદેવને આગા પડેંચાડી. સહદેવે નિકુલને. નિકુલે આવીને ભીમસેનને પૂછ્યું: 'ભાઈ! ધર્મરાજ પૂછાવે છે કે-આ શાનાં નગારાં વગાડો છો?' ભીમસેને ઉપેક્ષા કરી એને નગારાં ચાલુ રાખ્યાં! નકુલ નારો ભાઈ, ભીમસેનને શું કહે? સહદેવને બની બીજા જણાવી. સહદેવ આખ્યા. ભીમસેને તેને ય ન સાંભળ્યા. સહદેવે જઈને અજ્ઞુંનને આ વાન કરી.

અર્જુન જાતે આવ્યા. પણ ગદાયુદ્ધ-નિષ્ઠુત ભીમ તેને ગાડી ? કહી દીધું : ‘ ધર્મરાજને જાણું હશે તો જાતે આવશે ’ અને નગારાં ગગડાવે જ રાખ્યાં ! અર્જુન પણ ભીમને શું કરે ? તેણે જઈને યુધિષ્ઠિરને કહ્યું. ધર્મરાજ પોતે પધાર્યા. આડી નજરે મોટાબાઈને આવતા જોઈને ડાખલ જોરથી નગારાં વગાડના માંઝાં. નળક પધાર્યા જોઈને પ્રણામ કર્યા. યુધિષ્ઠિરે બાઈને બાથમાં લઈને વહાલથી પૂછ્યું : ‘ લાઈ ! આ શાનાં નગારાં ? ’

### મહોત્સવનાં નગારાં !

ભીમે યુધિષ્ઠિરને કહ્યું : ‘ મોટાબાઈ ! આ કાંઈ યુદ્ધનાં નગારાં નથી, આજ મારે મહોત્સવ છે, એનાં આ નગારાં છે.’ યુધિષ્ઠિરે પૂછ્યું : ‘ વહાલા બંધુ ભીમસેન ! આજે એવો કયો મહોત્સવ છે ? ’ ભીમસેન કહ્યું કે—‘ લાઈ યુધિષ્ઠિર ! આજનો ઉત્સવ અપૂર્વ છે, ગાનીએ તો કહે છે કે આયુષ્યનો ક્ષણુનો ય લડંસો નથી, પરંતુ આજે મને ખાત્રી થઈ છે કે—મારા વડીલ બંધુ યુધિષ્ઠિર અત્યારથી ચોવીશ કલાક સુધી તો અમર જ છે. આ મહોત્સવ જેવો તેવો છે ! ’ વાત સાંકળી યુધિષ્ઠિર તો સ્તખ્ય જ થઈ ગયા ! એાલ્યા : ‘ આ વળી કોણે કહ્યું ? ’ ખાલિણુ તરફ આંગળી કરી ભીમસેન કહ્યું કે—આ ખાલિણુને ‘ કાલે આવને ’ એમ આપ સત્યવાદી સારે જ કહેને કે—‘ આપશ્રી આવતી કાલ સુધી તો છો જ, એમ આપશ્રીએ જાણું હોય.’ ધર્મરાજ મર્મ પામી ગયા. ખાલિણુને આખિસન આપી ગ્રેમથી ઉડાડીને ઘરિછત દાન આપવા પૂર્વી દાનધર્મનો પોતે ધરેલો ૮ થી ૧૨નો નિયમ ભૂલ રૂપે જણાવાથી જુંસી નાંખ્યો ! દાતાના સંખ્યાએ તથા પરિચારકો પણ આમ આત્માની ઉત્તીલા માટે જીવતા કે-જેએ. આ રીતે અવસર પામીને દાતા એનું પણ આત્માની ઉત્તીલા તરફ લક્ષ દોરતા.

ઉક્કટર દર્દીને પૂછે, ‘તને શું થયું છે ?’

દાનધર્મ સોથી પહેલો કલ્યો. પોતાનું તો સહુ ભરે છે. કુકડી પણ ઉકરડે પોતાનું તથા બચ્ચાનું પોષણું ક્યાં નથી કરતી ? દુર્ગતિના હસાએ આપણે જોઈ ગયા ડે-ધર્મ વિનાનું માનવ જેવું અનુપમ જીવન પણ ભારે જોખમી છે. આથી જ આત્માની ઉત્તીત ઈચ્છનાર માનવને ધર્મ આવસ્યક છે. હાનીએ માનવને ધર્મ કલ્યો. કેમકે-તે મન પર લે તો સ્વપરનો ઉપકાર કરી શકે તેમ છે. એકનિર્યાહ પાંગળા પ્રાણીએ શું કરવાના ? તેને પ્રવચન શું કરે ? પ્રવચનનો સાર એકજ ડે-‘સર્વ પ્રાણી સેવા માગે છે માટે સેવા કરો.’ એક પરગળું વૈઘ હતો. નિષ્ણાત તેમજ ધર્મનિષ્ઠ હતો. એના હૈયામાં સેવાધર્મ જરૂર્યો હતો. ગામે-ગામ ધરે-ધર ફરી પદરતી પણ દવા કરને. એક ગરીઅ ઝૂંપડામાં તે પેડો. ગરીઅ માઆપ, હીણુક્ષીણુ દર્દીની પાસે લમણે હાથ ટેકાવી રડતાં બેઠાં હતાં. સાત દિવસથી પિતૃલક્ષ્મા ગરીઅ દીકરો તાવે ફૂફડતો હતો. આવાનાં સાંસાંમાં વૈઘ કર્યાંથી લાવે ? વૈઘના હૈયામાં દ્વારા હૈય તો આવા વખતે તે છાની રહે ? આવાને લાંય પૈસા મળે તો જ જય ? આ ઉપકારી વૈઘ તો વગર તેડે ગયો. માને પૂછયું. માએ કહ્યું: ‘ભાઈ ! ભારા આ એકના એક છોકરાને સાત દિવસથી તાવ આરે છે. ખાધું નથી.’ સ્વાર્થીએ સેવાના ઝૂમઅરાડ ગમે તેટલા મારે, છાપામાં જાહેરાતો કરે, ફંડ્ઝાળા ઉધરાવે, પણ જોશો તો તેઓમાં સાચી સેવાની આ ગંધ પણ હોતી નથી. સેવામાં સ્વાર્થને તો સર્વથા હોમી હેરો પડે છે. વૈઘ જોયું તો નાડમાં રોગ જણ્યાયો નહિ. આજના ડોક્ટરો ભુંગળાં મૂકે, છતાંય દર્દીની પૂછે: ‘તને શું થયું છે ?’ અભ્યા ! તારે ભુંગળાનો અર્થ શો ? પણી વળી ફોટાનું કહે. લોહી તપાસવાનું કહે, દશ-નીષ છિંજકથનો દોંચવાને બાને ફ્રી તરીકે છોડેલા ગરીભોનો ય ચાર્ફ છિંડાવે ! વાત મર્યાદિત સમય જ કરે ! સીધો જવાઅ ન આપે !

ઓક વાત એ વાર ન પૂછાય! જરા ખુસ્થી સારી ન મળે તો સાહેઅ નારાજ થાય! આવા વૈદ-ડોક્ટરો વગર ચેસે સેવા કરે તો ય સેવક કેમ ઠરે? સેવક તો સમર્પિત હોય. આ વૈઘ સહવૈઘ હતો. નિષ્ણાત હતો. એવો નાડીવૈઘ હતો ડે-નાથી જ દરદ જાણો. ખેલાં એવા નાડીવૈઘો હતા ડે-દરદી શું ખાધું તે દ્શપાવી ન શકે. પૂછવામાં આવે ડે-' શું ખાધું ? ' દરદી ગાંઠીઓને અફલે અજિયાં કહે, તો વૈઘ પકડી પાડે. કારણ ડે-તેઓાનું લક્ષ નાણુા તરફ નહિ પણ આત્મા તરફ હતું.

### આપણે ધણું આખળ બધવાનું છે

વાત એમ હતી ડે-પેલો પુત્ર પાન-ખીડીનો સામાન્ય ધધો કરતો હતો. ખીડી વેચતાં દાણુા આવતાં તેમાં માતા-પિતા અને પોતે એમ ત્રણ જણાનું પેટ ભરાતું. એટલા જ માત્ર દાણુા આવતા. હૈવયોગે એત્રણ દ્વિસ લાગટ દાણુા એણા આવ્યા. પોતે ખાય તો માતા-પિતા ભૂખ્યાં રહે, એ ચિંતાથી પુત્ર-' મિત્રને ત્વા ખાધું છે' એમ કહી મુખ પાલટયા વિના લાગટ ભૂખ્યો રહ્યો. એને આવ્યો ભૂખનો કાળીએ તાવ. પછી તો કમાઢને કોણ લાવે? એટલે બધાયનું અનુ અંધ થયું! આમ ભૂખમાં ભળી ચિંતા! આમ પુત્રના તાવનું કારણ હતું માતા-પિતાની અક્રિત. આનું નામ પુત્ર! કેવો ભાતૃપિતુ લક્તા? આત્માની ઉત્તરિ આવા પુત્રો સાધી જાય. આજ તો વીસમી સદી, સ્વતંત્રતાનો જમાનો, માને કહી હે-' કેવી ઝીઢી ચુસ્ત છે? ટકટક કર્યો જ કરે છે! મારી વાઈક તો મેદ્રિક્યુ-લેટ છે, સુશક્ષિત છે, નોઅલ છે.' આવા પુત્રો મા-આપનું શું ઉકાળે? માથાપનું ન ઉકાળે તે આત્માનું શું ઉકાળવાના હતા? પેલો ભૂખ્યો રહેનાર પણ જૈન ન હતો, અનૈન હતો. જૈન તો અટું કરે. જૈન તથા ધર્તર સંકૃતિમાંનો ઇરક અહિં ઉધારો

થાય છે. નૈન બાલક તારેકના ખમીર્યોગે ચાલતાં છટુ-અહુમ કરે. જ્યારે છતરોમાં ઉપવાસ કરે ત્યારે તો એ ઉપવાસની યાદી એને દશ વાર ખાવાનું મંગાવે! કહેવરાવે ઉપવાસ અને અઢીશેર ફરાળ કરે! આત્મોનતિમાં નૈન બાળપણું આઠલો આગળ હોય. આપણે કયાં ઉલા છીએ એ વિચારી ધારું આગળ વધવાનું છે.

### આનું નામ સેવક અને સેવાધર્મ!

ચેલા વૈઘને નાડમાં રોગ ન જણાયો. મા-આપથી સામાન્ય સંચોગાની કાળજીપૂર્વક માહિતી મેળવી લીધી. મા-આપને જરા બહાર જવા વિનવીને દર્દી છોકરાને વૈહે વહાલથી કહ્યું: ‘ભાઈ! મૂંજાઈશી નહિ. તારો રોગ પરખાયો. લે આ પચ્ચાસ ઇપીઆ. એ જ તારી દવા છે!’ પેલો કહે: ‘ન લઉં.’ ગરીબ આત્માનું પણ કેવું સુંદર આત્મધર્મતર? ખરેખર, યોગ્યને આપવું પણ સુંદેલ છે. વૈહે ખુઅ૰ી કરીઃ ‘ભલા આદમી! તો તારાં મા-આપ જુનશી રીતે? કુમાય ત્યારે પાછા આપજે!’ આ રીતે પરાણે ઇપીયા આપ્યા. કયા હુદ્દે આ થયું હશે? વિચારો. આનું નામ કહેવાય સેવક અને સેવાધર્મ. આપણું પણ આનું ગમી જય છે ને? ગમે છે તો કરવા માંડને, આત્માની ઉત્તરિત કરવી છે ને? કરવી હોય તો આમ થશે. વૈહે પરાણે ઇપીયા દીખા અને તેનો રોગ મટાજો. આ સેવાધર્મમાં વૈહે પચાસ જોખા તેમાં ‘દાનધર્મનો સુમાવેશ થાય છે, ગરીબ કુદુંબના ધરમાં પેસીને નિર્ધિન દર્દીની પણ સારવાર માટે ખાસ રોકાઈને દર્દીને લેતાં સંક્રાચ ન આવે એ રીતે પદરના પણ ઇપીયા માતા-પિતાને દુર કરીને દર્દીને સમજનીને આપ્યા, એ સદ્ગારરૂપ શીલધર્મનો સમાવેશ થાય છે, અને ઉત્તમ લાવના તો પ્રત્યક્ષ જ હોવાથી લાવનાધર્મનો પણ સુમાવેશ થાય છે.’ આ રીતે દાનધર્મ જેમ ચારે પ્રકારના ધર્મમાં

એક વાત એ વાર ન પૂછાય! જરા ખુદશી સારી ન મળે તો આહેઅ નારાજ થાય! આવા વૈદ-ડોકટરો વગર પૈસે સેવા કરે તો ય સેવક કેમ હરે? સેવક તો સમર્પિત હોય. આ વૈધ સહવૈધ હતો. નિષ્ઠાત હતો. એવો નારીવૈધ હતો કે-નારીઓ જ દરદ જણે. પહેલાં એવા નારીવૈધો હતા કે-દરદી શું ખાદું તે ધૂપાવી ન શકે. પૂછવામાં આવે કે-' શું ખાદું ? ' દરદી ગાંઠીઓને અદલે જનિયાં કહે, તો વૈધ પકડી પાડે. કારણ કે-તેઓનું લક્ષ નાણ્યા તરફ નહિ પણ આત્મા તરફ હતું.

### આપણે ધણ્ય આખળ વધવાનું છે

વાત એમ હતી કે-પેલો પુત્ર પાન-ભીડીનો સામાન્ય ધંધો કરતો હતો. ભીડી વેચતાં દાખા આવતાં તેમાં માતા-પિતા અને પોતે એમ ત્રણ જણ્યાનું પેટ ભરાતું. એટલા જ માત્ર દાખા આવતા. હૈવ્યોગે એત્રણ દ્વિસ લાગટ દાખા એઓછ આવ્યા. પોતે ખાય તો માતા-પિતાનું રહે, એ ચિંતાથી પુત્ર-' મિત્રને ત્યા ખાદું છે ' એમ કહી ભૂખ્ય પાલટયા વિના લાગટ ભૂખ્યો રહ્યો. એને આવ્યો ભૂખ્યનો કાળીએ તાવ. પછી તો કમાછને કોણું લાવે? એટલે અધ્યાત્મનું અન અધ્ય થયું ! આમ ભૂખ્યમાં લળી ચિંતા ! આમ પુત્રના તાવનું કારણ હતું માતા-પિતાની અક્રિતિ. આનું નામ પુત્ર ! કેવો આત્મપિતૃ અક્રિત ? આત્માની ઉજ્વિતિ આવા પુત્રો સાધી જાય. આજ તો વીસમી સદી, સ્વતંત્રતાનો જમાનો, માને કહી હે-' કેવી ઝાડી ચુસ્ત છે ? ટકટક કર્યા જ કરે છે ! મારી વાઈઝ તો મેદ્રિક્યુલેટ છે, સુશ્વક્ષિત છે, નોઅલ છે.' આવા પુત્રો મા-'આપનું શું ઉકાળે ? માથાપનું ન ઉકાળે તે આત્માનું શું ઉકાળવાના હતા ? પેલો ભૂખ્યો રહેનાર પણ જૈન ન હતો, અનૈન હતો. જૈન તો અદૃમ કરે. જૈન તથા ઈતર સંકૃતિમાનો ઈરક અહિં ઉધાએ

થાય છે. નૈન બાલક તારકના ખમીરથોડે ચાલતાં છઠ-અટું કરે. જ્યારે છતરોમાં ઉપવાસ કરે ત્યારે તો એ ઉપવાસની યાદી એને દશ વાર ખાવાનું મંગાવે! કહેવરાવે ઉપવાસ એને અઠીશેર ઝરાળ કરે! આત્મોનતિમાં નૈન બાળપણ આટલો આગળ હોય. આપણે કયાં ઉલા છીએ એ વિચારી ખાળું આગળ વધવાનું છે.

### આણું નામ સેવક અને સેવાધર્મ!

પેલા વૈઘને નાડમાં રોગ ન જણ્યો. મા-આપથી સામાન્ય સંયોગોની કાળજીપૂર્વક માહિતી મેળવી લીધી. મા-આપને કરા બહાર જવા વિનવીને દર્દી છોકરાને વૈદે વહાલથી કહ્યું: ‘ભાઈ! ભૂંઝાઈશ નહિ. તારો રોગ પરખાયો. લે આ પચ્ચાસ રૂપીઆ. એ જ તારી દવા છે!’ પેલો કહે: ‘ન લઉં.’ ગરીબ આત્માનું પણ કેલું સુંદર આત્મધંતર? ખરેખર, યોગ્યને આપણું પણ સુંદર છે. વૈદે ખુખ્ખી કરી: ‘ભલા આદમી! તો તારાં મા-આપ જીવશે શી રીતે? કમાય ત્યારે પાછા આપને!’ આ રીતે પરાણે રૂપીયા આપ્યા. કયા હૃદયે આ થયું હશે? વિચારો. આનું નામ કહેવાય સેવક અને સેવાધર્મ. આપણું પણ આવું ગમી જય છે ને? ગમે છે તો કરવા માંડને, આત્માની ઉત્તેના કરવી છે ને? કરવી હોય તો આમ થશે. વૈદે પરાણે રૂપીયા દીધા અને તનો રોગ મટાઓ. આ સેવાધર્મમાં વૈદે પચાસ જોખા તેમાં ‘દાનધર્મનો ચમાવેશ થાય છે, ગરીબ કુટુંબના ધરમાં પેસીને નિર્ધિન દર્દીની પણ સારવાર માટે ખાસ રોકાઈને દર્દીને લેતાં સંકાય ન આવે એ રીતે પદરના પણ રૂપીયા માતા-પિતાને દુર કરીને દર્દીને સમજનીને આપ્યા, એ સદ્ગારરૂપ શીલધર્મનો સમાવેશ થાય છે, અને ઉત્તમ જીવના તો પ્રત્યક્ષ જ હોવાથી જીવનાધર્મનો પણ સમાવેશ થાય છે.’ આ રીતે દાનધર્મ જેમ ચારે પ્રકારના ધર્મમાં

